




કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ:
નવા 43 મંત્રીનાં શપથ

PAGE NO. 16



દિલીપકુમારની દુનિયાને અલવિદા
Page 09, 15

કોરોના સામે લડવા 23,123 કરોડનું પેકેજ

15 હજાર કરોડની જોગવાઈ મોદી સરકાર કરશે, રાજ્યોએ 8000 કરોડની વ્યવસ્થા કરવી પડશે

નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રચાયેલી નવી કેન્દ્રીય કેબિનેટની ગુરુવારે મળેલી સૌપ્રથમ બેઠકમાં કોરોના મહામારી સામે લડવા રૂપિયા ૨૩,૧૨૩ કરોડના ઈમર્જન્સી રિસ્પોન્સ પેકેજને મંજૂરી અપાઈ હતી. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, એપ્રિલ ૨૦૨૦માં કેન્દ્રીય કેબિનેટે કોરોના ઈમર્જન્સી રિસ્પોન્સ માટે રૂપિયા ૧૫,૦૦૦ કરોડના પેકેજને મંજૂરી આપી હતી જેનો મહત્તમ ઉપયોગ દેશમાં આરોગ્ય માળખાને સુધારવા કરાયો હતો. કોરોનાના બીજા તબક્કા બાદ અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રૂપિયા ૨૩,૧૨૩ કરોડના પેકેજની જાહેરાત કરીએ છીએ.

ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવા માટે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરાશે. જેથી ઓક્સિજન, બેડ અને મહત્વની દવાઓની અછતનો દેશ સામનો કરવો ન પડે. ૨૩,૧૨૩ કરોડ પૈકી કેન્દ્ર સરકાર ૧૫,૦૦૦ કરોડની જોગવાઈ કરશે જ્યારે રૂપિયા ૮૦૦૦ કરોડની વ્યવસ્થા રાજ્યો કરશે. કોરોના રિલીફ ફંડ અંતર્ગત દેશના ૭૩૬ જિલ્લામાં પિડિયાટ્રિક કેર સેન્ટર તૈયાર કરાશે. તે ઉપરાંત ૨૦,૦૦૦ આઈસીયુ બેડની વ્યવસ્થા કરાશે. આ સિવાય જિલ્લા સ્તરે એક કરોડ દવાઓ ઉપલબ્ધ કરાવાશે. જો કોરોનાના કેસમાં વધારો થશે તો ટૂંકાગાળામાં ૫૦૦૦ અને ૨૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી ફિલ્ડ હોસ્પિટલો તૈયાર કરાશે. ૮ મહિનામાં રાજ્યોમાં ૧૦ હજાર લીટર ઓક્સિજન સ્ટોરેજ સિસ્ટમ બનાવાશે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીની વ્યવસ્થા નાબૂદ કરાશે નહીં પરંતુ વધુ મજબૂત બનાવવામાં આવશે.



પીએમ મોદીની નવી કેબિનેટના પહેલા દિવસે જ મહત્વના નિર્ણય

■ ૩.૧ લાખ કરોડનું એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હવે એપીએમસી માટે ઉપલબ્ધ ■ સહકારી સંઘો, સ્વસહાયતા જૂથો અને એપીએમસી ૩.૧ લાખ કરોડનું એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી સહાય મેળવી શકશે ■ એગ્રી સ્ટાર્ટઅપ અને ખેડૂત જૂથોને ૩.૦૬ કરોડ સુધીની લોન પરનાં વ્યાજમાં ૩ ટકાની છૂટ ■ એક વ્યક્તિ અલગ અલગ વિસ્તારમાં મહત્તમ ૨૫ પ્રોજેક્ટ પર લોન મેળવી શકશે ■ આ દરેક પ્રોજેક્ટ માટે ૩.૦૬ કરોડ સુધીની લોન પર વ્યાજમાં ૩ ટકા સુધીની છૂટ ■ એપીએમસીને ખેડૂતો માટે એકથી વધુ યોજના માટે આ પ્રકારની લોન અપાશે ■ નાસ્ચિયોન પકવતા ખેડૂતો માટે નાસ્ચિયોન બોર્ડની રચના કરાશે

પેરિસમાં આવેલી ભારતની 20 સંપત્તિ જમ કરવા કેઈન એનર્જીને ફ્રેન્ચ કોર્ટની મંજૂરી

નવી દિલ્હી

બ્રિટનની કેઈન એનર્જી કંપનીએ ભારત સરકાર પાસે ૧.૭ બિલિયન ડોલરની વસૂલાત માટે ફ્રાન્સની અદાલતમાંથી પેરિસ સ્થિત ભારત સરકારની ૨૦ સંપત્તિ જમ કરવાનો આદેશ અદાલત પાસેથી પ્રાપ્ત કરી લીધો છે. પેરિસના મધ્યમાં આવેલી ભારત સરકારની આ સંપત્તિમાં મોટાભાગે ફ્લેટ આવેલા છે અને તેમનું મૂલ્ય ૨૦ મિલિયન યૂરો એટલે કે ૨૪ મિલિયન અમેરિકન ડોલર છે. ફ્રાન્સની કોર્ટ ટ્રિબ્યૂનલ જ્યુડિશિયરી દ્વારા પેરિસે ૧૧ જૂને કેઈન એનર્જીની મધ્ય પેરિસમાં આવેલી ભારત સરકારની માલિકીની રીઅલ એસ્ટેટ સંપત્તિને જ્યુડિશિયલ મોર્ગેજના માધ્યમથી ફીઝ કરવાની માગ કરતી અરજી મંજૂર કરી હતી. આ માટેની તમામ કાયદાકીય પ્રક્રિયા બુધવારે સાંજે પૂરી કરી લેવામાં આવી હતી. ભારતીય અધિકારીઓને



હાંકી કાઢે તેવી સંભાવના ઘણી ઓછી છે પરંતુ ભારત સરકાર આ સંપત્તિનું વેચાણ કરી શકશે નહીં. કેઈન એનર્જીની પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ભારત સાથે સર્વસંમત સમાધાન કરવા તૈયાર છીએ અને આ માટે અમે ફેબ્રુઆરી ૨૦૨૧માં ભારત સરકાર સમક્ષ વિગતવાર પ્રસ્તાવો રજૂ કરી ચૂક્યા છીએ પરંતુ કોઈ સમાધાનની આશાઓ નહીં દેખાતા કેઈન એનર્જીએ તેના આંતરરાષ્ટ્રીય શેરહોલ્ડરોનાં હિતોને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ કાયદાકીય પગલાં લેવા પડશે.

કોરોના સામે કેન્દ્ર સરકારનો નવો મોરચો

૭૩૬ જિલ્લામાં પિડિયાટ્રિક કેર સેન્ટર તૈયાર કરાશે
૨૦,૦૦૦ આઈસીયુ બેડ તૈયાર કરાશે
૪૩૮૯ કોવિડ હોસ્પિટલ હાલ ઉપલબ્ધ
૮૩૩૮ કોવિડ હેલ્થ સેન્ટર હાલ ઉપલબ્ધ
૧૦,૦૦૦ કોવિડ કેર સેન્ટરઉપલબ્ધ
૪,૦૦,૦૦૦થી વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ કરાશે

SUPER VISA INSURANCE
Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote...

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

Need mortgage financing?
Look no further. Let me make it happen.

RBC Royal Bank

BHAVIN PATEL
Mobile Mortgage Specialist
Royal Bank of Canada
bhavin.patel@rbc.com
mortgage.rbc.com/bhavin.patel Cell: 647-502-8069
Serving Greater Toronto Region Fax: 416-253-9461

છેલ્લા ૪૪ વર્ષથી દેરાન્તીની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ દેરાન્તીમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Residential
New Condos
Investments
Commercial

દુસામાં યાદ રાખરો
Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office: 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage
Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email: patelzakir82@gmail.com

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002



સંપૂર્ણ વેક્સીનેટેડ કેનેડીયન પ્રવાસીઓને છુટછાટ

પ્રવાસીએ કોવિડને કારણે અમલી બનેલો ફરજિયાત ક્વોરન્ટાઈનનો નિયમ પાળવો પડશે નહીં

ટોરોન્ટો : વિદેશથી પાછા ફરી રહેલા કેનેડીયનોએ સોમવારે રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે આ અઠવાડિયાથી અમલમાં આવે એવી ક્વોરન્ટાઈનની છુટછાટોની જાહેરાત થઈ હતી. જો કે, આ રાહત ફક્ત એવા કેનેડીયનો માટે છે જેમણે કેનેડામાં માન્ય હોય એવી કોવિડ-19ની વેક્સીનના બંને ડોઝ લઈ લીધા હોય. હવે પછીથી આવા નાગરિકોને 14 દિવસના ફરજિયાત ક્વોરન્ટાઈનથી મુક્તિની જાહેરાત થઈ હતી. જેને પગલે હવે જે હોટેલોને સરકારે

માન્યતા આપી હોય ત્યાં ત્રણ દિવસના ફરજિયાત હોટેલ ક્વોરન્ટાઈનથી પણ આવા પ્રવાસીઓને મુક્તિ મળી શકશે. ટોરોન્ટોના પીઅરસન ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અમેરીકાથી આવનાર જુલિયા ડુને કહ્યું હતું કે, આ જાહેરાતથી તેને ઘણી રાહત થઈ છે. કેમકે વિદેશથી પરત આવ્યા બાદ વધુ બે અઠવાડિયા સુધી પરિવારથી દૂર એકલા રહેવાનું ઘણું



મુશ્કેલ લાગે છે. ડુને મૂળ કેપ બ્રેટોનની વતની છે અને હાલમાં હ્યુસ્ટનમાં રહે છે. એને જ્યારે ખબર પડી કે કેનેડામાં

ક્વોરન્ટાઈનના નિયમો હળવા થવાના છે ત્યારે તેણે થોડા અઠવાડિયા પહેલા ફ્લાઈટ બુક કરાવી હતી. ન્યુ જર્સીથી પોતાના પતિ સાથે ટોરોન્ટો આવનારી ડેનિસી સલિવાએ પણ કેનેડામાં નિયમો હળવા થવાની રાહ જોઈ હતી. ત્યારબાદ જ ટ્રીપ બુક કરાવી હતી. આ યુગલ તેમની સગર્ભા પુત્રીની ખબર કાઢવા પશ્ચિમ કેનેડા આવ્યા છે. જેની

ડીલીવરી ટૂંક સમયમાં થનાર છે. તેણે કહ્યું હતું કે, અમને ખરેખર રાહત થઈ ગઈ છે અમે મે માસથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે નિયમો હળવા થાય અને અમે ફરજિયાત ક્વોરન્ટાઈનથી બચી શકીએ. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ કહ્યું હતું કે, નિયમો હળવા કરવાનું પગલું ખરેખર મોટું પૂરવાર થશે. જેનાથી પરિવર્તનનું પ્રમાણ પણ વધશે. અમારા બધા એરપોર્ટસને સજજ રાખવા માંગીએ છીએ. જેથી પ્રવાસીઓના વધારાના ધસારાને પહોંચી વળી શકાય.

ટોરોન્ટોથી ક્યુબેક સુધી નવી હાઈ ફ્રિક્વન્સી રેલ યોજનાની જાહેરાત

ટ્રેનની ઝડપ વધુ હોવાથી ઓછા સમયમાં લાંબુ અંતર કાપી શકાશે

ટોરોન્ટો : સરકારે નવી હાઈ ફ્રિક્વન્સી રેલ લાઈન યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રોજેક્ટમાં ટોરોન્ટો, ઓટાવા, મોન્ટ્રીયલ અને ક્યુબેક સીટીને આવરી લેવાશે. આ સુચિત રેલ લાઈન યોજના સાકાર થશે તો બંને શહેરો વચ્ચેના પ્રવાસના સમયમાં ઘણો ઘટાડો થશે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓમર અલગાબ્રાએ આ જાહેરાત ટોરોન્ટોથી મોન્ટ્રીયલ રેલવે માર્ગે જતા પેસેન્જરો સમક્ષ આ જાહેરાત કરી હતી.



બજેટમાં રેલ પ્રોજેક્ટ માટે 491.2 મિલીયન યુએસ ડોલરની ફાળવણી

પબ્લીક એક્સ સિસ્ટમથી પેસેન્જરો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ ટ્રેનોની ફ્રિક્વન્સી પણ વધુ હશે એટલે બે શહેરો વચ્ચેનું અંતર ઓછા સમયમાં તમે કાપી શકશો. આ ટ્રેનો અત્યારની ટ્રેનોની સરખામણીમાં વધુ ઝડપે દોડનારી હશે. જો કે, સરકાર આ સેવાને હાઈ સ્પીડ સેવા તરીકે ઓળખાવવા નથી માંગતી.

કેમ કે, યુરોપ અને એશિયામાં પણ હજુ હાઈ સ્પીડ રેલવેના નેટવર્ક તૈયાર થયા નથી. લિબરલ સરકાર અત્યારે તો આ પ્રોજેક્ટને હાઈ ફ્રિક્વન્સી રેલ તરીકે ટોરોન્ટો અને ક્યુબેકને જોડવા માંગે છે. જેની શરૂઆત તો 2019થી થઈ

ગઈ હતી અને સરકારના બજેટમાં એને માટે 491.2 મિલીયન યુએસ ડોલરની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.

જે આવનારા છ વર્ષમાં વીઆઈએ રેલ કેનેડાના નામે કરવામાં આવી છે. જો કે, બજેટમાં આ પ્રોજેક્ટ માટે કોઈ ચોક્કસ તારીખ કે સમય મર્યાદાની સ્પષ્ટતા નથી. સરકાર હવે હાઈ ફ્રિક્વન્સી રેલ લાઈન પ્રોજેક્ટમાં ટોરોન્ટો, ઓટાવા, મોન્ટ્રીયલ અને ક્યુબેક સીટીને જોડવાની યોજના પર આગળ વધી રહી છે.

આ સુચિત રેલ લાઈનથી પ્રવાસના સમયમાં 25 ટકાનો ઘટાડો થઈ શકશે અને સમયસર પહોંચવાનો દર 25 ટકા જેટલો જોવા મળશે. આ લાઈન પર ટ્રેનો અંદાજે 190 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે. જો કે મિનિસ્ટરે તો એ ઝડપે 200 કિ.મી સુધી વધી શકે એવી પણ જાહેરાત કરી હતી.

ઓન્ટેરિયોમાં સ્વયં સેવકો માટે વચગાળાનો પગાર વધારો કરાશે

ટોરોન્ટો

ઓન્ટેરિયોના પ્રિમીયર ડગ ફોર્ડે કહ્યું હતું કે, તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન કામ કરનારા કાયમી પર્સનલ સપોર્ટ વર્કર્સને કામચલાઉ પગાર વધારો કરવાનું વચન આપ્યું છે અને એ જરૂર એને પાળશે. તેમણે કહ્યું કે, હું જાણું છું કે આ વધારો માત્ર 3 યુએસ ડોલરનો અને કામચલાઉ જ છે. આમ છતાં તેઓ લાંબાગાળા માટે લાભો વિશે પણ

ઓન્ટેરિયોએ 147000 પીએસડબલ્યુ માટે કામચલાઉ પગારવધારો જાહેર કર્યો હતો. જેમાં કમ્યુનિટી કેરના સ્ટાફ, લોંગ ટર્મ કેર હોમ્સના કર્મચારીઓ, જાહેર હોસ્પિટલોનો સ્ટાફ અને બાળકોને

સેવાઓ પુરી પાડનારાઓનો સમાવેશ થાય છે. એના માટેનું ભંડોળ તો માર્ચ 2021માં પુરૂ થનાર હતું. પરંતુ બે વાર એની મુદત વધારવામાં આવી હતી. જે ર20મી ઓગસ્ટ સુધીની છે. જુનમાં છેલ્લી જાહેરાત કરતી વખતે

કોવિડના કપરા કાળમાં કામ કરનારાઓની ઓન્ટેરિયોના પ્રિમીયર ડગ ફોર્ડે સરાલના કરી

વિચારશે. નોર્થ બે ખાતે આ જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ વર્કર્સને ખૂબ જ વધારે કામ કપરા સમયમાં કર્યું છે. અને તેઓ ઓછા વળતર સાથે કામ કરી રહ્યા હતા. એ બધા જ વધારા માટે લાયક છે અને હું એ વાતની ખાતરી આપું છું કે, અમને એમના હકનો વધારો જરૂરથી મળશે. આ અગાઉ 2020ના ઓક્ટોબરમાં

અધિકારીઓએ કહ્યું હતું કે, કામચલાઉ ધોરણે કલાકના 2 કે 3 યુએસ ડોલરનો વધારો મદદરૂપ બનશે અને કપરા સમયમાં લોકોને મદદરૂપ થવા માટે પ્રોત્સાહક બનશે. ઓક્ટોબરમાં ફોર્ડે કહ્યું હતું કે, કાયમી ધોરણે પગાર વધારા વિશે વિચારવામાં આવશે. જો કે, આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.



ટોરોન્ટોમાં હાઉસિંગ માર્કેટને ઠંડુ પાડવા ખાલી મકાનો પર ટેક્સ લદાશે

ટોરોન્ટો : ટોરોન્ટોમાં ખાલી પડેલા મકાનોના માલિકો ઉપર નવા ટેક્સની તલવાર તોળાઈ રહી છે. મંગળવારે મળેલી સીટી કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીએ આ નવા ટેક્સની યોજનાને મંજૂરી પણ આપી છે.

જેનો અમલ વર્ષ 2022થી થનાર છે. સીટી કાઉન્સિલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ નવા ટેક્સનો આશય ખાલી મકાનોના વર્તાવમાં બદલાવ લાવવાનો છે. જેથી તેઓ પોતાના ખાલી પડેલા મકાનો વેચવા માંડે અથવા ભાડે આપે, જેથી હાઉસિંગના પુરવઠાને પહોંચી વળાય.

નવા ટેક્સનો અમલ પહેલી જાન્યુઆરી, 2022થી થશે અને એ તારીખ જ ટેક્સના સંદર્ભ માટેની તારીખ બનશે. અહેવાલ મુજબ ટેક્સનો દર પ્રોપર્ટીની વર્તમાન બજાર કિંમતના એક

ટકા જેટલો રહેશે.

એ જે વર્ષ દરમિયાન મકાન ખાલી રહ્યું હોય, એના ઉપર લાગુ થશે. જો કે, હાલમાં ટોરોન્ટોમાં કેટલા મકાનો ખાલી પડ્યા છે, એની ચોક્કસ જાણકારી નથી છતાં ય વાન્કુવરના ટેક્સ માળખાને ધ્યાને રાખીએ તો આ નવા કાનૂનથી અંદાજે 55 મિલીયન યુએસ ડોલરનો દર વર્ષે વધારો થશે.

જે વર્ષ 2023માં ભરવાનો થશે. જે અગાઉના વર્ષમાં કેટલો સમય એ મકાન ખાલી રહ્યું એનો આધાર રહેશે. અગાઉના વર્ષમાં કમસેકમ છ મહિના એ મકાન ખાલી ન રહ્યું હોવું જોઈએ. જે મકાન માલિકનું મૃત્યુ થયું હોય અથવા જે મકાન માલિક સારવાર હેઠળ હોય અથવા એ મકાનનું રીનોવેશન ચાલતું હોય એમને આ ટેક્સમાંથી મુક્તિ મળી શકશે.

બ્રિટીશ કોલંબિયામાં હીટવેવથી લાખો સમુદ્રી જીવ મોતને ભેટ્યા

કિટસીલાનો બીચ ઉપર જુનના અંતમાં સંશોધકે નુકસાનનો તાગ મેળવ્યો

બ્રિટીશ કોલંબિયા

વાન્કુવરના કિટસીલાનો બીચ ઉપર જુનના અંતમાં ચાલીને તાગ લેનારા સંશોધક ફિરસ હાલરીએ અસંખ્ય સમુદ્રી જીવોને મૃત અવસ્થામાં જોયા હતા. દરિયાકાંઠાના ખડકો સાથે ટકરાઈને હજારો છીદ્રો વાળી માછલીઓ, સમુદ્ર તારાઓ, ગોકળગાય અને છીપવાળી ખાદ્ય માછલીઓ હીટવેવને કારણે બફાઈને મૃત્યુ પામી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

તેણે કહ્યું હતું કે આ જોઈને મને મોટો આંચકો લાગ્યો હતો. હાલરી મરીન બાયોલોજિસ્ટ તરીકે યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલંબિયામાં કાર્યરત છે. તેમણે કહ્યું હતું કે, ગયા અઠવાડિયાના વિક્રમજનક હિટવેવને કારણે દરિયાકાંઠે જોવા મળતા એક અબજથી વધુ સમુદ્રી જીવો માર્યા ગયા હતા. આ તારણ એ દર્શાવે છે કે, હીટવેવને કારણે જે સિસ્મીક અસર થાય છે, એમાં સમુદ્રીજીવો બચી શકતા નથી. એમનો સમાવેશ પણ હીટવેવને કારણે



થયેલા મૃત્યુના આંકમાં થવો જોઈએ. હજારો લોકોની સાથે એક અબજથી વધુ સમુદ્રીજીવોએ પણ જાન ગુમાવ્યા હતા. આમ પર્યાવરણને પહોંચેલી અસર ઘણી મોટી હતી. વાન્કુવરમાં જ્યારે તાપમાન 70 સે.થી વધ્યું હતું ત્યારે બ્રિટીશ કોલંબિયાના અંતરીયાળ વિસ્તારોમાં એ પારો એનાથી પણ વધુ હતો. જે દરિયાકાંઠાના ખડકાળ વિસ્તારમાં તો 10 સે.થી પણ વધુ હોવાનો ઉલ્લેખ હાલરીએ કર્યો હતો. ગરમીને કારણે સમુદ્રી જીવો

બચી શક્યા નહોતા. વળી એ સમયે ઓટ હોવાથી કેટલાક જીવો તો સમુદ્રની વચ્ચે જ તણાઈ ગયા હતા. બપોરથી છ કલાક સુધી એમ જ રહેતા એ બધા બફાઈ ગયા હતા. ગોકળગાય અને સમુદ્રતારા જેવી માછલીઓ વધુ તાપમાન સહન નથી કરી શકતા એટલે બચી શક્યા નહોતા એમ પણ હાલરીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે શનિ, રવિ અને સોમવાર એમ ત્રણ દિવસ ચાલેલા આ હિટવેવને કારણે આ નુકસાનનું પ્રમાણ વધ્યું હતું.



કલાઈમેટચેન્જની માઠી અસર

ટોરોન્ટો

પશ્ચિમ કેનેડામાં તાજેતરમાં જોવા મળેલા હિટવેવે ભૂતકાળના બધા વિક્કમોને પાર કરી દીધો હતો અને હજારો લોકોના મોત પણ નિપજયા હતા. જેનું કારણ કલાઈમેટ ચેન્જ હોવાનું તારણ એક અભ્યાસમાં બહાર આવ્યું છે. આ અભ્યાસ વૈજ્ઞાનિકોના આંતરરાષ્ટ્રીય જુથે હાથ ધર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો વિશ્વ ગ્રીનહાઉસ ગેસ ઘટાડવાના લક્ષ્યને પાર પાડી શકે તો પણ બ્રિટીશ કોલંબિયામાં ૪૫ સે.નું જે તાપમાન જોવા મળ્યું હતું એવું જ દર પાંચ કે દશ વર્ષે થતું રહેશે એમ બુધવારે વર્લ્ડ વેધર એટ્રીબ્યૂશન

લવિષ્યમાં વધુ ગરમીનો સામનો કરવો પડે સૈવી સંલાવના: વિશ્વ ગ્રીનહાઉસ ગેસ ઘટાડવાના લક્ષ્યને પાર કરે તો પણ બ્રિટીશ કોલંબિયામાં હિટવેવ જારી રહેવાનું તારણ

BCના હિટવેવમાં અધધ.. વધારો

ગૃપે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું. ભૂતકાળમાં આટલી હદે તાપમાનમાં વૃદ્ધિ જોવા મળી નથી. એમ રોયલ નેધરલેન્ડ્સ મીટીયરોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટના અહેવાલના સહલેખક સારાહ કેવે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં આથી વધુ તીવ્રતા સાથેના હિટવેવનો સામનો પણ કરવો પડી શકે છે. જુનના અંતમાં અને જુલાઈના પ્રારંભમાં બ્રિટીશ કોલંબિયા અને અલ્બર્ટામાં આ રીતે તાપમાનમાં વધારો થવાની શક્યતા રહે છે. વિટોનના લોકોએ તો ૫૦ સે. સુધીની ગરમીનો અનુભવ કર્યો હતો. જે જંગલની આગને કારણે થનારી ગરમીની યાદ

અપાવનારો હતો. અચાનક ગરમી વધવાને કારણે બ્રિટીશ કોલંબિયામાં ૭૧૯ લોકોના મોત નિપજયા હતા. ઓક્ફોર્ડ યુનિવર્સિટીના ગીર્ટ જેન વાન ઓડેનબર્ગે કહ્યું હતું કે, આપણે તાપમાનમાં આટલો મોટો ઉછાળો ક્યારેય જોયો નથી, જે આ હિટવેવમાં હતો. આટલી ગરમી તો ઉષ્ણકટીબંધ વિસ્તારમાં જ પડે છે. સંશોધકોએ જુદા જુદા ૨૧ કલાઈમેટ મોડેલ્સનો અભ્યાસ કરીને અને આંકડાકીય જાણકારીના વિશ્લેષણ બાદ બાદ આ અહેવાલ તૈયાર કર્યો હતો. ધી વર્લ્ડ વેધર એટ્રીબ્યુશન ગૃપે આવા અસંખ્ય અભ્યાસો હાથ ધર્યા છે.

સ્ટુડન્ટ્સ અને પીજીડબલ્યુપી હોલ્ડર્સને પણ પરમેનન્ટ રેસીડેન્ટનું સ્ટેટસ આપવાની સરકારની તૈયારી

ઈમિગ્રન્ટ્સ-આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને કારણે કેનેડાની કુલ વસતીમાં વધારો

ટોરોન્ટો - વૈશ્વિક મહામારી બાદ વર્ષ ૨૦૨૧ના પહેલા ક્વાર્ટરમાં કેનેડાની વસતીમાં વધારો થયો હોવાની જાણકારી તાજેતરના આરસીબી રીપોર્ટમાં મળી રહી છે. જેનું કારણ કેનેડામાં આવી રહેલા ઈમિગ્રન્ટ્સ અને ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનું પ્રમાણ છે. કોવિડ-૧૯ પહેલાની સ્થિતિ તરફ પાછા ફરવાના આ સંકેતો છે એમ પણ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. પહેલા ક્વાર્ટરમાં ૮૨૦૦૦ની વસતીનો વધારો નોંધાયો હતો. જે ઈમિગ્રેશનને કારણે હતો. સરકારે કેનેડાના ટેમ્પરરી રેસીડેન્ટ્સને પરમેનન્ટ રેસીડેન્ટ તરીકે માન્યતાની અરજી કરવા પ્રોત્સાહન આપ્યું હોવાથી આ શક્ય બન્યું છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને પીજીડબલ્યુપી હોલ્ડર્સને પણ પરમેનન્ટ રેસીડેન્ટનું સ્ટેટસ આપવાની સરકારની તૈયારીને કારણે પણ ઈમિગ્રેશનમાં વધારો થયો છે. નવી સ્ટડી પરમીટમાં આ વર્ષે ૪૪ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૦થી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો આંક ૬૦૦૦૦ જેટલો ઘટી ગયો હતો. જ્યારે આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં આઈઆરસીસીએ ૨૧૦૦૦ નવી પરમીટ ઈસ્યુ કરી છે.



આવશ્યક ૨.૧ ટકાથી ઘણો ઓછો છે. કુદરતી કમમાં થતા વધારાનો આધાર જન્મદર અને મૃત્યુ દર ઉપર હોય છે. જે અત્યાર સુધીમાં સૌથી ઓછો ૬૪૦૦૦ છે. એ મહામારીને કારણે વધેલા મૃત્યુદરને લીધે જ છે. હવે કોવિડ-૧૯ની તીવ્રતા ઓછી થઈ છે. આમ છતાં કુદરતીકમમાં વસતી વધારો થવામાં સમય લાગશે. એટલે જ ઈમિગ્રેશનને વધારવા સરકાર પ્રયાસ કરી રહી છે.

આરસીબીના અહેવાલમાં અર્થશાસ્ત્રી એન્ડ્રુ એગોપ્સોવિક્સે જણાવ્યું છે કે, આ દર્શાવે છે કે, ફેડરલ સરકાર ઈમિગ્રેશન વધારવા કેટલી ઉત્સુક છે. પહેલા ચાર મહિનાના આંકડા દર્શાવે છે કે, કેનેડા ૪૦૧૦૦૦ના નવા ઈમિગ્રન્ટ્સના લક્ષ્યને પાર નહીં કરી શકે. કેનેડાએ પહેલા ક્વાર્ટરમાં ૭૦૫૦૦ નવા ઈમિગ્રન્ટ્સને પ્રવેશ આપ્યો છે અને એપ્રિલમાં બીજા ૨૧૧૦૫ને આપ્યો છે. મે માસથી ડીસેમ્બર સુધીમાં બીજા ૩૮૬૭૫ ઈમિગ્રન્ટ્સને પ્રવેશ આપશે.

ડીસેમ્બર સુધીમાં બીજા ૩૮૬૭૫ ઈમિગ્રન્ટ્સને પ્રવેશ અપાશે, નવી સ્ટડી પરમીટમાં ચાલુ વર્ષે ૪૪ ટકાનો વધારો થયો

આગામી ચૂંટણીમાં મહામારી નહીં પણ અર્થતંત્ર મહત્વનો મુદ્દો હશે

ઓટાવા

શું વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો આ ઉનાળામાં ચૂંટણી યોજશે એ વિશે એક સર્વે નેનોસે હાથ ધર્યો હતો. જેમાં મહામારી નહીં પણ દેશનું અર્થતંત્ર મતદારો માટે મહત્વનો મુદ્દો બની શકે એવું તારણ નીકળ્યું હતું. સરવેમાં ભાગ લેનારા પૈકી ૨૮ ટકા એવું માને છે કે, દેશના અર્થતંત્રનો મુદ્દો જ એમના માટે મહત્વનો હશે. પર્યાવરણ અને કોવિડ-૧૯ મહામારીના મુદ્દા ત્યારપછીના ક્રમે હશે.

બીજો મહત્વનો મુદ્દો પર્યાવરણ બની શકે છે. કેમકે ૧૭ ટકાએ એને મહત્વ આપ્યું હતું. ૧૬ ટકાએ સરકારની ખાધને મહત્વ આપ્યું હતું. જ્યારે ૧૩ ટકાએ હેલ્થકેરને મહત્વ આપ્યું હતું. મહામારી પાંચમા ક્રમે હતી જેને માત્ર ૧૦ ટકાએ મહત્વ આપ્યું હતું. ત્યારબાદ સ્થાનિક વતનીઓના મહત્વને ૭ ટકા

અને નવી સરકારની અપેક્ષાને મહત્વ આપનારા માત્ર ૨ ટકા હતા. બુધવારે મીડિયા સાથેની મુલાકાતમાં નેનોસ રીસર્ચના નિક નેનોસે કહ્યું હતું કે, કેનેડીયનો મહામારીના મુદ્દાથી દૂર રહેવા માંગે છે એવું લાગી રહ્યું છે. પ્રેરીઝમાં રહેનારા કેનેડીયનો માને છે કે, અર્થતંત્ર અને રાજકીય પક્ષોની નાણાકીય વ્યવસ્થા મજબૂત હોવી જરૂરી છે. જ્યારે બ્રિટીશ કોલંબિયાના લોકો પર્યાવરણને વધુ મહત્વ આપે છે. ઓન્ટેરિયોમાં રહેનારાઓએ મહામારીના મુદ્દાને વધુ મહત્વ આપ્યું હતું. એટલાન્ટીક કેનેડીયનો હેલ્થકેરને મહત્વ આપે છે. મહામારી દરમિયાન કેનેડીયનોએ આરોગ્ય અને અર્થતંત્રની મુશ્કેલીઓ જોઈ હોવાથી અને લોકડાઉનને કારણે વધેલી બેરોજગારીથી બહાર જલ્દી આવી શકાય એવું આયોજન કરનારી સરકારને પસંદ કરવાનો અભિગમ દર્શાવ્યો હતો.

LIFE INSURANCE
MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$500,000		\$1000,000	
	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00

ALSO AVAILABLE

- ★ NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85)
(Even if you have DIABETES, BLOOD PRESSURE, HEART ATTACK, STROKE)
CANCER OR INSURANCE declined by other companies
- ★ CORPORATION OWNED LIEF / CRITICAL ILLNESS INSURANCE
(Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- ★ MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRSP, RESP, TFSA

Visitor To CANADA INS, TRAVEL INS, Lite ins For Refugees & Work Permits
Email : - Davindersinghfh@gmail.com
www.financialhuttd.com

416.320.4614 Toll : 1866.623.0865 Call For HONEST ADVICE

SUPER VISA INSURANCE
HARD TO BEAT OUR PREMIUMS

THINKING OF INVESTING?
INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE
SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

INVEST WITH **Metrobuild Capital**
Sharia'h Compliant

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects **plus** your investment is secured against the assets.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માં અમારી પાસે ઘણાં જુદા જુદા રોકાણોનો વિકલ્પ છે જ્યાં તમને રોકાણ પર ૮-૧૨% સુધીનું વળતર અને તમારું રોકાણ સંપત્તિ સામે સુરક્ષિત હોય છે.

CALL 416 893 4585 TODAY!!!

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર
અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહનો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.

Call us TODAY for all of your Real Estate Needs and get Honest, Reliable and Courteous Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX
#SellWithABOWATH
your Local REALTOR

*Not intended to Solicit client under contract.



તંત્રી સ્થાનેથી

દિલીપ કુમાર : સિનેજગતનો કોહીનૂર સદાય ઝગમગતો રહેશે

હિન્દી ફિલ્મ જગતમાં મહાન અભિનેતાઓ પૈકી એક દિલીપ કુમારે બુધવારે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી. આમ તો છેલ્લાં ઘણાં વર્ષોથી દિલીપકુમારની



તંત્રી - પ્રકાશક
સ્વદેશ

તબિયત લથડવાના સમાચારો વારંવાર આવતા રહ્યા હતા. દરેક વખતે દિલીપ કુમાર મોતને માત આપીને હસતા મુખે ઘરે પરત ફરતા હતા. પરંતુ 2021ના જુલાઈ મહિનામાં તેઓ મોત સામેનો જંગ હારી ગયા. ૯૮ વર્ષની જૈફ ઉમરે દિલીપ કુમારનું મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું. દિલીપ કુમારની ફિલ્મી કારકિર્દી ઘણી લાંબી છે. હિન્દી ફિલ્મ જગતમાં તેમણે પોતાની કળાથી આપેલા યોગદાનને કદી ભૂલી શકાય તેમ નથી. હિન્દી ફિલ્મોમાં એક સમયે દિલીપકુમાર, દેવાનંદ અને રાજ કપૂરની ત્રિપૂતિની બોલબાલા હતી. દિલીપ, દેવ અને રાજ ત્રણેયનો આગવો અંદાજ હતો. ત્રણેય અભિનેતાનો અલગ ચાહક વર્ગ હતો.

દિલીપ મજબૂત અભિનેતા હતા તેમાં કોઈ શંકા નથી. રાજ કપૂર કે દેવાનંદના અભિનયની બહુ મર્યાદાઓ હતી. દિલીપકુમાર દેવદાસ, મેલા, અંદાઝ, મુગલે આઝમ, બાબુલ, દીદાર વગેરે ફિલ્મોમાં રોતલ હીરોનો અભિનય કરતા નજરે પડ્યા હતા. ફિલ્મોમાં કોમેડી કરવી સૌથી કપરી છે અને હિન્દી ફિલ્મોમાં મોટાભાગના અભિનેતા કોમેડી કરવા જાય ત્યારે હાસ્યાસ્પદ લાગે છે. દિલીપકુમાર તો કોમેડી કરવામાં પણ કિંગ હતા. વાસ્તવમાં હિન્દી ફિલ્મોમાં હીરો પોતે કોમેડી કરે એવો ટ્રેન્ડ દિલીપકુમારને કારણે જ શરૂ થયો હતો. અમિતાભ બચ્ચને કોમેડી અને એક્શનની ભેળપુરી બનાવીને હિન્દી ફિલ્મોમાં બાદશાહત ભોગવી છે. જે બાદ ગોવિંદા, અક્ષયકુમાર જેવા હીરોએ એ પરંપરાને શાનદાર રીતે આગળ ધપાવી છે. એ જમાનાના પ્રદીપકુમાર, ભારત ભૂષણ સહિતના હીરોને તો કોમેડી સાથે દૂર દૂર સુધી કંઈ લેવાદેવા નહોતી. રાજ કપૂર અને દેવાનંદ જેવા મોટા સ્ટાર પણ મ્યુઝિકને કારણે ચાહકોના દીલમાં રાજ કરી શક્યા. જ્યારે દિલીપકુમાર તો સાવ જુદા હતા.

શરૂઆતનાં વરસોમાં પણ દિલીપકુમારે તરાના, આઝાદ, મુસાફિર, નયા દૌર વગેરે ફિલ્મોમાં કોમેડી કરી બતાવી હતી. એ જમાનાના મોટાભાગની હીરો ડાન્સ કરી શકતા નહોતા. તેનું કારણ એ કે, મોટાભાગના હીરો યુવા જ નહોતા લાગતા. પ્રદીપ કુમાર અને ભારત ભૂષણ જેવા હીરો તો પ્રૌઢ જ જન્મ્યા હોય એવા લાગતા હતા. હવે તેના અંગત જીવન પર નજર કરીએ તો તેમણે પણ વિચાર્યું ન હશે કે દુનિયા તેના અસલી નામને બદલે દિલીપકુમારના નામથી યાદ કરશે. દિલીપકુમારનું અસલી નામ યુસુફ ખાન હતું. મોહમ્મદ સરવર ખાન નામના મુંબઈના ફળોના વેપારીના પુત્ર યુસુફ ખાને પહેલા તો પિતાના વ્યવસાયમાં જોતરાવુ પડ્યું હતું. દિલીપકુમારનો જન્મ આમ તો પેશાવરમાં થયો હતો. પરંતુ તેમનું આખું બાળપણ મુંબઈમાં વીત્યું હતું. યુસુફખાનને ફળોના કારોબારમાં જરા પણ રસ ન હોવાથી એક દિવસ તેને આ બાબતે પિતા સાથે ઝગડો થયો અને તેઓ મુંબઈ છોડી પુના ચાલ્યા ગયા. ઘર તો છોડી દીધું પરંતુ રોજરોટી માટે શું કરવું તેનો તેમને જરાય ખ્યાલ ન હતો. તે સમય આઝાદીની લડતનો હતો અને દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજો પર સારી પકડને કારણે તેમને પુનામાં બ્રિટીશ આર્મીની કેન્ટીનમાં આસિસ્ટન્ટની નોકરી મળી. કેન્ટીનમાં જ તેમણે પોતાનું અલગ સેન્ડવીચ સેન્ટર ખોલ્યું જે અંગ્રેજો સૈનિકોમાં ઘણું લોકપ્રિય થયું. પરંતુ તે પછી કેન્ટીનમાં એક દિવસ

તેમણે અંગ્રેજો વિરુદ્ધ બોલીને આઝાદીની લડતનું સમર્થન કર્યું અને નોકરી ગુમાવીને જેલભેગા થવું પડ્યું. આખરે જેલમાંથી છૂટ્યા બાદ કમને તેઓ મુંબઈ પરત ફર્યા અને પિતાના વ્યવસાયમાં જોડાયા. જો કે, તેને તેમાં જરાય રસ ન હતો.

આ દરમિયાન એક દિવસ દાદર જવા માટે ચર્ચગેટ સ્ટેશન પર લોકલની રાહત જોતા યુસુફખાનને તેનો મિત્ર ડો. મસાની મળ્યો. ડો. મસાની બોમ્બે ટોકીઝના માલિકણ દેવિકા રાનીને મળવા માટે જઈ રહ્યા હતા. તેથી તેણે યુસુફ ખાનને પણ તેના સાથે જવા કહ્યું. દિલીપ કુમાર ડો. મસાની સાથે સ્ટુડિયો પહોંચી ગયા. અને યુસુફ ખાનની બોમ્બે ટોકીઝની આ મુલાકાતે તેમની જીંદગી બદલી નાંખી. તે સમયે બોમ્બે પ્રોડક્શન સૌથી સફળ પ્રોડક્શન હાઉસ હતું અને દેવિકા રાણી અભિનેત્રી હોવા સાથે હિરા પારખું પણ હતા. તેણે દિલીપકુમારને સ્ટુડિયોમાં કામ કરવાની ઓફર કરી. જે બાદ તેઓ સ્ટુડિયોમાં આખો દિવસ અશોક કુમાર, શશિધર મુખરજી તથા અન્ય કલાકારોને અભિયન કરતા જોવા લાગ્યા. દેવિકા રાનીએ જ તેમને દિલીપકુમાર નામ રાખવાનું સુચન કર્યું.

જો કે, દિલીપકુમારને તે મંજૂર ન હતું તેમ છતાં તેમણે વિચાર માટે સમય માંગ્યો. કેટલાક સમય બાદ તેઓ તે નામ રાખવા સમંત થયા અને આ સાથે રૂપેરી પરદે દિલીપકુમાર નામના કલાકારનો જન્મ થયો. 1947માં નુરજહા સાથેની જુગ્નુ સુપરહિટ થઈ અને દિલીપકુમારનો સિક્કો ચાલવા લાગ્યો તે પછી તે વર્ષે જ પાંચ ફિલ્મ આવી. જેમાં મેલા અને શહીદ સુપર હીટ થઈ. એક સમયે મોતનું દ્રશ્ય ભજવવા જતા તેઓ વિષાદમાં સરી પડ્યા અને તે પછી સાઈકોલોજિસ્ટે તેમને હળવા રોલ કરવાની સલાહ આપી. જે બાદ તેમણે ગંગા જમના, રામ ઓર શ્યામ જેવી ફિલ્મોમાં હળવા પાત્રો પણ બખૂબી નિભાવ્યા. તેમના અભિનયમાં એક પ્રકારની શાંત શક્તિ હતી. તેમણે લાંબા વિરામ સાથે ડાયલોગ બોલવાની કળા વિકસાવી અને દર્સકોના દિલ પર તે ખૂબ મોટી અસર કરી ગઈ.

બીજી ઈનિગ્સમાં તેમણે સાચા અર્થમાં જેને યાદગાર કહેવાય એવા રોલ કર્યા. દિલીપસા'બે ૧૯૪૪ની જવારભાટાથી શરૂ કરીને ૧૯૭૬ની બૈરાગ સુધી હીરોના રોલ કર્યા પછી બ્રેક લીધો હતો. પાંચ વર્ષ પછી તેમણે ૧૯૮૧માં કાંતિ ફિલ્મથી પુનરાગમન કર્યું અને કદી ના ભૂલાય એવા રોલની વણઝાર સર્જી દીધી. કાંતિ ટિપિકલ મનોજકુમાર સ્ટાઈલની દેશપ્રેમની ફિલ્મ હતી પણ દિલીપકુમારે સાંગાના રોલમાં જમાવટ કરી દીધી હતી. ૧૯૮૨ની શક્તિ હિન્દી સિનેમામાં એક માઈલસ્ટોન કહેવાય છે કેમ કે તેમાં હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠતમ અભિનેતાના બિરૂદ માટે લાયક બે ધુરંધરો દિલીપસા'બ અને અમિતાભ બચ્ચનની ટક્કર આ ફિલ્મમાં હતી. રમેશ સિપ્પીએ શોલે જેવી બ્લોકબસ્ટર અને ઓલટાઈમ એન્ટરટેઈનર બનાવી પણ શક્તિ કદાચ સિપ્પીની શ્રેષ્ઠ ફિલ્મ છે. સલીમ-જાવેદે આ ફિલ્મમાં દિલીપસા'બ-બચ્ચનની ટક્કરના જે સીન ક્રીએટ કર્યા છે એ જોઈને આફરીન થઈ જવાય.

તેમણે ૧૯૮૨માં એવી જ બીજી જોરદાર ફિલ્મ વિધાતા આપી. સુભાષ ઘાઈની વિધાતામાં સંજીવકુમાર અને શમ્મી કપૂર જેવા ધુરંધરો હતા પણ ગંગસ્ટર શોભરાજ તરીકે દિલીપસા'બનો ઠંડકભર્યો અભિનય જોઈને ફિદા થઈ જવાય. યશ ચોપરાની મશાલ અને રમેશ તલવારની દુનિયા પણ દિલીપકુમારના દમદાર અભિનયના કારણે જામી હતી. દિલીપસાબના મોત સાથે હિન્દી સિનેમાનો એક યુગ પૂરો થયો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

Manoj Gadhvi

manoj1968@yahoo.ca

RE/MAX
REALTY SERVICES
INC., BROKERAGE
INDEPENDENTLY OWNED AND OPERATED



JAY PATEL
BROKER

647.241.3818
jaypatel1323@gmail.com



"Let Me Make Your Dream Home Into A Reality"

Residential, Commercial & Investment in Real Estate

Off : 905.456.1000 | Fax : 905.456.1924
295 Queen Street East, Brampton, On., L6W 3R1



ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice
✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach
✓ Bedbug

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



✓ Animal Control
✓ Bird Control
✓ WASPS and
✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા ક્યોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)

\$6.50 +Tax



CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise
Opportunity
in GTA

Call us for details

રસોઈકામ
કરી શકે તેવા
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine
Special
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.



ધાનેરા નગરપાલિકામાં બળવો થયો ભાજપના બે હોદ્દેદારોની હકાલપટ્ટી

બનાસકાંઠા

ધાનેરા નગરપાલિકામાં બળવાખોર સદસ્યોને ટેકો કરનાર સામે કાર્યવાહી કરી જિલ્લા ભાજપ પ્રમુખે કડકાઈ દાખવી ભાજપના જ બે જિલ્લા હોદ્દેદારોને સસ્પેન્ડ કરતા જિલ્લા ભાજપમાં બળભંગાટ મચી ગયો છે. બનાસકાંઠા ભાજપના મંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદી તેમજ અનુજાતિ મોરયાના મહામંત્રી રાયચંદભાઈ વાધેલા સામે જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે કડક કાર્યવાહી કરી બંનેને હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના શાસન વખતે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ભાજપ સદસ્યોએ રજૂઆત કરી હતી. જે બાદ કોંગ્રેસના 15 સદસ્યો

સસ્પેન્ડ થયા હતા. જેને લઈને ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ માટેની ચૂંટણી 18 જૂને યોજાઈ હતી. જેમાં ભાજપ પક્ષે જ્યોત્સનાબેન ત્રિવેદીને મેન્ડેડ આપ્યું હતું. જોકે તેમની સામે ભાજપના જ કિરણબેન સોનીએ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી હતી અને જેમાં ભાજપના અન્ય 5 સભ્યોએ તેમને પક્ષ વિરોધમાં જઈને ટેકો આપતા ભાજપના બંને ઉમેદવારો માટે મતદાન થતાં બંનેને 6-6 સભ્યોના મત મળતાં ટાઈ થઈ હતી. જે બાદ ચિટ્ટી ઉછાળતા બળવાખોર કિરણબેન સોની પાલિકાના પ્રમુખ બન્યા હતા. જોકે, ભાજપ પક્ષે ધાનેરા પાલિકાના પ્રમુખ સહિત 6 સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા.

કલોલમાં ધારાસભ્યના બંધ મકાનમાંથી રૂપિયા 8.51 લાખ મત્તાની ચોરી

કલોલ : કલોલ શહેરમાં હાઈવે રોડ ઉપર મકાન ધરાવતાં કલોલના ધારાસભ્યના બંધ મકાનમાં ગઈરાત્રીએ તસ્કર ટોળી ત્રાટકી હતી અને મકાનનું તાળું તોડી મકાનમાંથી સોનાચાંદીના દાગીના, રોકડ રકમ, ત્રણ એલઈડી ટીવી તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી ૮.૫૧ લાખ રૂપિયાની મત્તા ચોરી લીધી હતી. આજે સવારના સમયે ગાંધીનગરમાં રહેતા ધારાસભ્યને ચોરીની ઘટના અંગે જાણ થતાં તેઓ કલોલ પહોંચ્યા હતા અને આ મામલ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તસ્કરોનું પગેરૂ મેળવવા દોડધામ શરૂ કરી હતી.

ઝાલાનું સસ્પેન્શન રદ થતા મહેસાણા કોંગ્રેસના 200 આગેવાનો ભડક્યાં

- પાર્ટી નિર્ણય નહીં બદલે સામુહિક રાજીનામા આપવા ચીમકી આપી મહેસાણા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે ઉમેદવારોની ટિકિટ ફાળવણી અને મેન્ડેડ પહોંચાડવાના મામલે આચરવામાં આવેલી ગેરરીતિના મુદ્દે ચાર મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસના તે વખતના મહામંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં તેઓનું સસ્પેન્શન રદ થતા મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. આ મુદ્દે બુધવારે વિસનગર ખાતે

નારાજ જુથના સ્થાનિક આગેવાનોએ ગુમ બેઠક યોજી હતી. જેમાં હાજર રહેલા કોંગ્રેસના કાર્યકરોએ બળાપો કાઢીને કીર્તિસિંહનું સસ્પેન્શન કાયમી રાખવામાં આવે તેવો ઉગ્ર સુર વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે પ્રદેશ પ્રમુખ તેમજ દિલ્હી જઈને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિસનગરમાં ગુમ સ્થળે આ નિર્ણયનો વિરોધ દર્શાવવા નારાજ જુથના કોંગ્રેસના સ્થાનિક આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ૧૦ તાલુકામાંથી ૨૦૦થી વધુ કાર્યકરોએ હાજરી આપી હતી. કાર્યકરોએ પાર્ટીના નિર્ણય સામે રાજીનામાની ચીમકી આપી હતી.

પાટણના જગદીશ મંદિરે નેત્ર પૂજન વિધિ યોજાઈ

પાટણ : પાટણમાં ભગવાન જગન્નાથજીના મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પ્રતિમાને બહાર લાવી તેઓની આંખે રેશમી પાટા બાંધી શોકત મંત્રોચ્ચાર સાથે નેત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આગામી શનિવાર સુધી ધર્મ પ્રેમી જનતાને ભગવાનના દર્શન માટે બહાર રાખવામાં આવશે તેમ જગદીશ મંદિરના પુજારી કનુભાઈ શુક્લ એ જણાવ્યું હતું. ભગવાન જગન્નાથજી, ભ્રાતા બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મામાના ઘરે જતા તેમને આંખો આવતા પરંપરા અનુસાર ભગવાનની આંખો ઉપર મધ સાકર,વરિયાળી ગુલાબજળ તજલવીંગના રસ મળી પંચામૃત દ્વારા નેત્ર પૂજન કરવામાં આવ્યા હતા.

ભગવાનને બાંધેલ પાટા વિધી વિધાન સાથે આગામી શનિવારે ખોલવામાં આવશે.

બદામકંપા પાસે 3 ફેક્ટરીમાં ધાડપાડુ ટોળકી ત્રાટકી : ચપ્પુની અણીએ લૂંટ

- 43 હજારની મત્તા લૂંટી ટોળકી ફરાર : સીસીટીવી કેમેરામાં શપ્સો દેખાયા તલોદ

તલોદ તાલુકાના બદામકંપા પંથકમાં આવેલા જલારામ ઈન્ડસ્ટ્રીઝમાં બુધવારે રાત્રે મધ્યરાત્રી બાદ ત્રાટકેલા ધાડપાડુઓએ ઈન્ડ.ની ઓફિસનું તાળુ તોડીને ઓફિસમાં ઘૂસ્યા હતા. જ્યાં તેઓએ ત્યાં સૂતેલા એકાઉન્ટન્ટના ગળા ઉપર તિક્ષ્ણ હથિયાર મુકીને હિન્દી ભાષામાં ચૂપચાપ પડી રહેવા આદેશ કર્યો હતો. જેને સુવાડી દઈ તેના ખીસ્સામાંથી રૂ. ૩૦૦૦ કાઢી લીધા હતા. બાદ ઓફિસમાં રાખેલ તીજોરી

કબોટ વગેરે ખોલી તોડીને આવેલ સૌતેક ધાડપાડુ ઈસમોએ રૂ. ૪૧,૦૦૦ની રોકડ રકમ ઉઠાવી લીધી હતી. સાતેકની સંખ્યામાં ચડી-બનીયાન ધારી ટોળકીની જેમ ત્રાટક્યા હતા. ધાડપાડુએ નજીકની ઈશ્વર પ્લાય એન્ડ ડોર નામની કંપનીમાં પણ ઘૂસ મારી હતી. અને બધી વસ્તુઓની તોડફોડ કરી હતી. આ ઈસમોએ પંથકના જે.જે.કોલેડ સ્ટોરેજમાં પણ ઘુસ મારીને હજારોની મત્તા લૂંટવાની કોશિષ કરી હતી.હરસોલ નજીકના બદામકંપા પંથકની આ ફેક્ટરીના પાછળના ભાગેથી ઘૂસેલા આ ધાડપાડુ ઈસમોએ એક બારીની ગ્રીલ તોડી સ્વાઈડર વીન્ડો ખોલી નાંખીને અંદર ઘૂસીને ધાડ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

કલોલ ખાતે પાણીજન્ય રોગચાળો : ત્રણના મોત

ગાંધીનગર : કલોલ શહેરમાં આવેલાં રેલ્વે પુર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી દુર્ગંધ યુક્ત દુષિત પાણી આવતું હતું. આ વિસ્તારમાં આવેલાં છાપરાઓ તેમજ સ્લમ વિસ્તારમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ નાના માણસનું અધિકારીઓ સાંભળતાં નથી જેના કારણે અહીં ગંભીર અને જીવલેણ પાણીજન્ય ઝાડા - ઉલ્ટીનો રોગચાળો ફેલાયો છે. રેલ્વે પુર્વના શ્રેયસના છાપરામાં રહેતી સાડા પાંચ વર્ષની બાળકી ઉપરાંત એક જ પરિવારના પિતા-પુત્રનું આ ઝાડા-ઉલ્ટીના રોગચાળામાં મોત નિપજ્યું છે. રોગચાળો ફેલાતાં આરોગ્યની ટીમે આ વિસ્તારમાં ઓપીડી ચાલુ કરી છે. જેમાં બે દિવસથી ૮૦થી પણ વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. રોગચાળાનું મુળ કારણ શોધવા માટે પાણી અને દર્દીના સમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

THANK YOU FRONTLINE WORKERS

**MORTGAGE DILIGENT**
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

5 Yrs Fixed @ 1.84%* High Ratio Only
5 Yrs Variable @ 1.15%* High Ratio Only
3 Yrs Variable @ 0.99%* (Special Promotion)

Rakesh Patel**
Vice President- Commercial.

Pranay Jani *



Nilesh Tailor *



Bala Shah*



Vijay Rana*

Rajesh Khurana, MBA
Principal Broker

Cell : 416-616-1300

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.* FSCO#10252,OAC,E&O.E * - Mortgage Agent, ** - Vice President

* Some conditions apply

ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપ શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો પૂછશે

અમદાવાદ : હાલોલના શિવરાજપુર નજીક આવેલાં જીમીરા રિસોર્ટમાં ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા પકડાયા હતાં. આ ઘટના બનતા ભાજપની રાજકીય આબરૂનું ધોવાણ થયું છે જેના કારણે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપ પક્ષ દ્વારા શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો પૂછવામાં આવે તેવી શક્યતા છે.

શિવરાજપુર તલાવડી રોડ પર આવેલાં જીમીરા રિસોર્ટમાં ખાનદાની નબીરા દાડુ જુગારની મહેફિલ માણી રહ્યા છે તેવી ખાતમી મળતા જ પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાં ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત અન્ય લોકો જુગાર રમતા પકડાયા હતાં. ઉલ્લેખનીય છે કે, આ રિસોર્ટમાં કેસીનો સ્ટાઈલથી જુગાર રમાડાય છે.

આ ઘટના બાદ ભાજપની પ્રતિષ્ઠા ખરડાઈ છે જેના કારણે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામે પક્ષીય કાર્યવાહીના એધાણ છે. સૂત્રોના મતે,

શિસ્તભંગના પગલાં લેવાશે કે પછી કાર્યવાહીનું નાટક ?

એકાદ સમાહમાં જ કેસરીસિંહ સોલંકીને શો કોઝ નોટિસ ફટકારી સમગ્ર ઘટના સંદર્ભમાં ખુલાસો પૂછવામાં આવશે.

જોકે, કાર્યકરોમાં ગણગણાટ છે કે, શું કેસરીસિંહ સોલંકીને શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો પૂછવાનો રાજકીય ડ્રામા કરાશે કે પછી ભાજપ ખુદ જ પક્ષની પ્રતિષ્ઠા વધુ ખરડતી અટકાવવા કેસરીસિંહ સોલંકીને ક્લિનચીટ આપી દેશે. પક્ષના પ્રવક્તાએ પણ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું કે, હજુ સુધી કેસરીસિંહ સોલંકીને પક્ષે કોઈ નોટિસ આપી નથી.

રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી મતદાન વખતે અચાનક બિમાર પડી ગયા હતા જેના કારણે પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચોધરીએ મત આપ્યો હતો. આ ઘટના પાછળની એવી ચર્ચા છે કે, કેસરીસિંહ સોલંકી કોંગ્રેસ સાથે હાથ મિલાવી કોસવોર્ટિંગ કરે તેવી ભાજપને જાણ થઈ હતી ત્યારથી આ ધારાસભ્ય ભાજપના હિટલિસ્ટમાં છે.

વેપારી સાથે ઠગાઈ કરનાર નાઈજિરિયન ગેંગ દિલ્હીથી ઝડપાઈ

વડોદરા : વેપારીને કોમ્પ્યુટરના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટના સ્કેપનો ઓર્ડર આપવાના નામે રૂ.૧૮.૩૫ લાખની ઠગાઈ કરનાર નાઈજિરિયન ગેંગના ૩ આરોપીઓને સાયબર સેલે દિલ્હીથી ઝડપી પાડીને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. સ્કેપનો વેપાર કરતા રાજેશ જેતિભાઈ પટેલે પોલીસ ફરિયાદ આપી હતી કે, તા.૨૬ નવેમ્બરના રોજ મેલ મારફતે નાઈજિરિયન ઠગ ટોળકીએ તેનો સંપર્ક કર્યો હતો અને તેઓની સાથે વાતચીત બાદ મેં તેઓને એક ટન કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટના સ્કેપનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ ૫૦ ટકા પેમેન્ટ એડવાન્સ આપવું પડશે, ઈન્સ્યોરન્સ કરાવવો પડશે તેમજ મટિરિયલ મિસપ્લેસ થઈ ગયું છે અને કોર્ટમાંથી સેટલમેન્ટ કરવું પડશે તેવા કારણો બતાવીને મારી પાસેથી રૂ.૧૮.૩૫ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.

વડોદરા જિલ્લા SOG પીઆઇના પત્ની એક માસથી રહસ્યમય ગુમ

વડોદરા જિલ્લા એસઓજી પીઆઇના પત્ની કરજણમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા સમગ્ર જિલ્લા પોલીસ દોડથી થઈ ગઈ છે. ૩૭ વર્ષના પત્ની ક્યાં સંજોગોમાં અને કેમ લાપતા થયા તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાં રહેતા જયદીપ મહેન્દ્રભાઈ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવેલી

ફરિયાદમાં જણાવ્યું છે કે મારી બહેન સ્વીટી કરજણ નવાબજાર વિસ્તારમાં ભક્તિનગર ત્રણ રસ્તા પાસે પ્રયોશા સોસાયટીમાં રહે છે. તેઓ તા.૬ જૂનના રોજ રાત્રે એક વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં પોતાનો ફોન અને બે વર્ષના પુત્ર અંશને મૂકીને કોઈને કહ્યા વગર જતા રહ્યા છે.

કરજણ પોલીસ દ્વારા શરૂઆતમાં ગુમ થયાની અરજી બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી જો કે તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો.

SOGના પીઆઇનો ફરી FSLમાં ટેસ્ટ કરાયો

વડોદરા જિલ્લા એસઓજીના પીઆઇ એ.એ. દેસાઇના પત્ની સ્વીટી કરજણથી ગુમ થવાના પ્રકરણમાં જિલ્લા પોલીસને હજુ સુધી કોઈ કડી મળી નથી. આજે ફરીથી પીઆઇનો એફએસએલમાં એસડીએસ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક મહિનો થવા છતાં પીઆઇ દેસાઇના પત્ની સ્વીટી ક્યાં છે તેના કોઈ સગડ નથી. એક મહિના સુધી સ્થાનિક પોલીસ દ્વારા તપાસ બાદ અચાનક ગૃહ વિભાગમાંથી સુચનાઓને પગલે વડોદરા જિલ્લા પોલીસ એલર્ટ થઈ અને પીઆઇને મહત્વના પદ પરથી હટાવી લિવ ડિઝર્વમાં મૂકી દીધા બાદ તેમના પત્ની સ્વીટી ગુમ થવા અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

ફૂવાઓ, અવાવરુ જગ્યાઓ, રેલવે ટ્રેકો, બસ સ્ટેન્ડ સહિત અનેક સ્થળે રાજ્યભરમાં તપાસ

વડતાલ ખાતે યોગીની એકાદશીએ 26 પાર્ષદોને ભાગવતી દિક્ષા અપાઈ

- નવ દિક્ષિતોને નૂતન નામાલિધાન કરાયું

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં યોગીની એકાદશીએ આચાર્ય મહારાજે ૨૬ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં બુધવારે યોગીની એકાદશીએ પાર્ષદોને દિક્ષા આપવામાં આવી હતી. લક્ષ્મીનારાયણદેવ પિઠાધીપતિ ૧૦૦૮ આચાર્ય રોકેશપ્રસાદજી મહારાજે ૨૬ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. આચાર્ય મહારાજે આજદિન સુધીમાં કુલ-૭૧૮ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી છે. આ અંગે વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંતસ્વામીએ

વધુમાં જણાવ્યું હતું કે વડતાલ ખાતે આજે વડતાલ, ગઢડા, જૂનાગઢના કુલ-૨૬ પાર્ષદોએ ભાગવતી દિક્ષા આપવાનો સમારોહ યોજાયો હતો. સવારે મંગળાઆરતી બાદ દિક્ષાર્થી પાર્ષદોએ ગોપાળાનંદસ્વામીના આસને પૂજામાં બેસાડયા હતા. પૂજા વિધિ બાદ પાર્ષદોને તેઓના ગુરુ દ્વારા સંતોના ભગવા વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ બાદ સવારે ૭:૦૦ કલાકે આચાર્ય રોકેશપ્રસાદજી મહારાજે દિક્ષાર્થીઓને સંતોને જનોઈ, કંઠી અને માળા ઘરણ કરાવી કાનમાં ગુરુમંત્ર આપ્યો હતો. આ પ્રસંગે મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી, સંત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સહિતના અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહી નવદિક્ષિત સંતોને આશીર્વાદ પાઠવ્યા હતા.

આણંદના યુવકનો મહીસાગરના બ્રિજ પરથી પડતું મૂકી આપઘાત

વડોદરા: ફાજલપુર ખાતે મહીસાગરના બ્રિજ પર બુધવારે બપોરે એક યુવક બાઈક પર આવ્યો હતો અને તેણે બાઈક પાર્ક કરી બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. બનાવના પગલે સ્થાનિક તરવેયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અંગે નંદેસરી પોલીસના હેડકો જશવંતભાઈ ખાંટે કહ્યું હતું કે, મૃતકનું નામ રણજિત સોલંકી હોવાનું ખૂલ્યું છે જે મોગર ગામનો રહેવાસી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક સવારથી નીકળી ગયો હતો અને ક્યા કારણસર આપઘાત કર્યો હતો તે જાણી શકાયું નથી.

વડોદરા નજીક કેનાલમાં ત્રણ શ્રમજીવી ડુબ્યા, એકનો બચાવ: બે ભાઈઓના મૃતદેહ મળ્યા

વડોદરા જારખંડથી આવેલા અને એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટર રોડનું કામ કરતા શ્રમજીવીઓ વડોદરા પાસે ભીમપુરા વિસ્તારની વસાહતમાં રહેતા હતા. મંગળવારે મોડી સાંજે ૩ શ્રમજીવીઓ ભીમપુરા સેવાસી વિસ્તારની કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડૂબવાનો બનાવ બન્યો હતો. અજય ભોઈયા, તેનો ભાઈ વિનોદ ભોઈયા અને સરજુ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક જણ કેનાલમાં લપસી પડતાં તેની સાથે બીજા બે જણ પણ કેનાલમાં પડ્યા હતા. જે પૈકી બે ભાઈઓ લાપતા થયા હતા જ્યારે સરજુ બચીને બહાર નીકળી ગયો હતો. બનાવના પગલે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાતા ફાયર બ્રિગેડે શોધખોળ કરી બંને ભાઈના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

Imperial

PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week

Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

1 Spray Services

2 Fogging Services

3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.
Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

First Time Customer gets

10% Off

on your first home service

*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

સ્વદેશ

CANADA

Registration # 869127209
Publication Mail Agreement /
Email : info@swadesh.news

WWW.SWADESH.NEWS

Return Undeliverable Canadian Address To :

Shree Balaji Inc.

MAILING ADDRESS

23 Lyric Road,
Brampton ON L6S 0B4.
416-996-7755

Registered Address

713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi

Director : Nilesh Tailor

Sub Editor : Chhaya Gandhi

Montreal Bureau : Vijay Patel (514-826-7442)

GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT (INDIA)

Designed By

Sabir Daroga

Mevada Piyush

Firoz Shaikh

Disclaimer : Swadesh is a weekly newspaper published by Shree Balaji Inc. in Gujarati Language. The opinions expressed in Swadesh may not be those of the publisher. Contents of this publication are covered by copyright and offenders will be prosecuted under the law.



જામનગરમાં સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેય બાળકોના ડૂબી જતા મોત

જામનગર

જામનગરમાં કચ્છ ઘટના સામે આવી છે. જામનગરના ખંભાળિયામાં આજે એક વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં પડી જતા ત્રણ માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ફાયરની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને ફાયરની ટીમ દ્વારા ત્રણ બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, જામનગરના ખંભાળિયામાં આવેલી

એક વાડીમાં ખેતમજૂરી કરી પરપ્રાંતિય પરિવાર પોતાનું ગુજરાન ચાલાવી રહ્યું હતું. ત્યારે આજે સવારે અગમ્ય કારણોસર મહિલાએ તેના ત્રણ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. જો કે, ઘટનાની જાણ થતા આસપાસના ગ્રામજનો એકત્રીત થઈ ગયા હતા અને મહિલાને તેમજ બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્રણેય બાળકોના કૂવામાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે ગ્રામજનો સમય રહેતા સ્થળ પર પહોંચી જતા મહિલાનો આબાદ બચાવ થયો છે. ગ્રામજનો દ્વારા આ સમગ્ર

મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા ત્રણ બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ત્રણેય બાળકોની ઉંમર 5 વર્ષ કરતા ઓછી છે. જેમાં 4 વર્ષની સૌથી મોટી બાળકી, અઢી વર્ષની બીજા નંબરની બાળકી અને આઠ માસના બાળકનું મોત નીપજ્યું છે. ત્યારે મહિલાએ ક્યા કારણોસર તેના ત્રણ બાળકો સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો તે જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છ જિ.પં.ની વિવિધ સમિતિઓમાં સભ્યોની વરણી, હવે ચેરમેનો વરાશે

- સમિતિઓના ચેરમેનો
કોણ બનશે તેની
અટકળો રાડ
ભુજ

કચ્છ જિલ્લા પંચાયતની નવી બોડીની આજે બીજી સામાન્ય સભા યોજવામાં આવી હતી. પ્રમુખ પારૂલબેન કારાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના સદસ્યોની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત દ્વારા વિવિધ આઠ સમિતિઓની અઢી વર્ષ માટેની રચનાને સદસ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી.

પ્રમુખ, ઉપપ્રમુખ વણવિરભાઈ રાજપુત અને સચિવ સભ્ય ભવ્ય વર્માની હાજરીમાં યોજાયેલ સામાન્ય સભામાં કાર્ય નોંધને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રથોતરી કરાઈ હતી જેમાં વિપક્ષી સદસ્યોએ સમસ્યાઓની ભરમાર રજૂ કરી હતી. વિપક્ષી ઉપ નેતા તકીશા બાવાએ પ્રારંભે બાઈક બંધ હોવાથી ઉગ્ર બની ગયા હતા. તેમણે અબડાસાના રસ્તાના મરંમતની માંગ કરી હતી તેમજ પ્રાધાન મંત્રી આવાસ યોજનામાં લઘુમતિઓને ન સમાવાવાનો આક્ષેપ કર્યો હતો. આરોગ્ય, તલાટી-શિક્ષકોની ઘટ, ગોચર વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઈ હતી.

ચોટીલા ગામના ભાજપ અગ્રણીનું ગાંધીનગરમાં રહસ્યમય મૃત્યુ

ચોટીલા

ચોટીલા પંથકના કોળી સમાજના અગ્રણી અને ગત ધારાસભાના ભાજપના ઉમેદવાર જીણાભાઈ ડેરવાડીયાનું ગાંધીનગરમાં રહસ્યમય મૃત્યુ થતા નશ્વર દેહ વતન લાવીને અંતિમ સંસ્કાર કરાયા હતા.

સોમવારે ગાંધીનગરમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ તેમનું મૃત્યુ નીપજતા પંથકમાં શોકનું મોજુ છવાયું હતું. લાખચોકીયા ગામે તેમનો નશ્વર દેહ આવી પહોંચતા પરિવારમાં હેયાફાટ આકંઠ છવાયો હતો. તેઓ ગત વિધાનસભાની ચોટીલા સીટના ભાજપના ઉમેદવાર હતા. સાંજે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા યાત્રા નીકળી હતી. જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ચોટીલા ડુંગર પર રોપ-વે પ્રોજેક્ટ સામે મંદિર ટ્રસ્ટની હાઈકોર્ટમાં PIL

સરકાર સહિતના

પ્રતિવાદીઓને નોટિસ

અમદાવાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલા ડુંગર પર હાથ ધરાનારા રોપ-વે પ્રોજેક્ટ સામે ચામુંડા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ટ્રસ્ટની ફરિયાદ છે કે અગાઉ જે કંપની પાસેથી અહીંના રોપ-વે પ્રોજેક્ટનો ડ્રાફ્ટ ઓર્ડર પરત લેવાયો હતો તેને જ ફરી રોપ-વે માટેનો ડ્રાફ્ટ ઓર્ડર ગત એપ્રિલમાં ગુપ્તતાથી ફરી આપવામાં આવ્યો છે. જેમાં મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા-વિચારણા પણ કરવામાં

આવી નથી. કોર્ટે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી આગામી સુનાવણી બે અઠવાડિયા બાદ નિયત કરી છે.

અરજદાર ટ્રસ્ટની રજૂઆત છે કે મંદિરની ટોચ પર આવેલા ચામુંડા માતાજીના મંદિર સુધી પહોંચવા દર્શનાર્થીઓએ હુપ પગથિયાં ચડવા પડે છે. જેથી સરકારે ૨૦૧૧માં માર્સ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડને અહીં રોપ-વે પ્રોજેક્ટ માટે ડ્રાફ્ટ ઓર્ડર આપ્યો હતો. જેની સામે ટ્રસ્ટે હાઈકોર્ટમાં રિટ કરતા સરકારે તે ડ્રાફ્ટ ઓર્ડર પરત કર્યો હતો. હવે રાજ્ય સરકારે ફરી ૫-૪-૨૦૨૧ના રોજ નોટિફિકેશન જારી કરી ફરી આ જ કંપનીને રોપ-વે પ્રોજેક્ટ માટે ડ્રાફ્ટ ઓર્ડર આપ્યો છે.

કચ્છના દરિયાઈ વિસ્તારમાં ફરી ચરસના ૧૯ પેકેટો મળી આવ્યા

ભુજ

લાંબા સમયાથી કચ્છના કાંઠાળ વિસ્તારમાં ચરસના પેકેટો મળી આવવાનો સીલસીલો યાથાવત રહેવા પામ્યો છે. કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન દરમિયાન આજે ચરસના ૧૯ પેકેટ જપ્ત કરાયા છે. આ બનાવમાં અન્ય પેકેટો દરિયાઈ વિસ્તારમાં વહેતા હોવાથી અવારનવાર મળી આવતા હોય છે. અગાઉ પણ કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યો છે. જો કે, ભારત-પાકિસ્તાની વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળ સીમામાં પેકેટો મળી આવવાની ઘટના પછી સુરક્ષા દળો વધુ સર્તક બન્યા છે. જેમાં કોસ્ટગાર્ડ, બીએસએફ, પોલીસ સહિતની એજન્સીઓ રાઉન્ડ ક્લોક પેટ્રોલીંગ કરી રહ્યા છે.

માંગરોળમાં પ્રેમ સંબંધ રાખવા માટે ઈન્કાર કરનાર યુવતીની હથિયારથી ઘાતકી હત્યા

માંગરોળ

માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે રહેતા નરેન્દ્રભાઈ રાજાભાઈ સોલંકીના પત્ની ભારતીબેનની માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ત્રણ ઘા મારી ઘર પાસે જ ફૂરતાપૂર્વક હત્યા નિપજાવાઈ હતી. બનાવ અંગે મૃતકના પતિ નરેન્દ્રભાઈએ પાડોશમાં રહેતા મનસુખ પીઠાભાઈ પરમાર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદીના પત્ની ભારતીબેન અને મનસુખને ત્રણેક વર્ષ પહેલાં અનૈતિક સંબંધો હતા. જેની જાણ થતા તેઓ માંગરોળ રહેવા આવી ગયા હતા. ત્યારબાદ તેઓના બાનું અવસાન થતા તેઓ ફરી ઢેલાણા રહેવા ચાલ્યા ગયા હતા. દરમિયાન ભારતી સાથે ધરાર સંબંધ રાખવા માંગતો મનસુખ સોમવારે પોતાના ઘર પાસે આવી ભારતીબેન સાથે ઝઘડો કરી

ઉશ્કેરાઈ કુહાડીના ઘા મારતાં તેનું મૃત્યુ થયું હતું. આરોપીએ ગુનાની કબૂલાત આપી છે કે ભારતીબેન સાથે ધરાર પ્રેમસંબંધ રાખવા થયેલો ઝઘડો અને પોતાની જમીન વેચીને આપેલા ત્રણથી ચાર લાખ રૂપિયાની રકમ બાબતની માથાકુટમાં આ ઘટના બની હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે અલગ-અલગ ટીમોએ શોધખોળ હાથ ધરી હત્યારાને કેશોદ તાલુકાના કેવડા ગામેથી દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી સાયકલ અને હત્યામાં વપરાયેલી કુહાડી અને કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ધરાર અનૈતિક સંબંધ રાખવા દબાણ કરતા પ્રેમીએ એક હસતા રમતા પરિવારને પીંખી નાખ્યો છે. હાલમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

ભાવનગરમાં પ૦થી વધુ સ્થળે GSTની ટીમના દરોડા, વેપારીઓમાં ગભરાટ

ભાવનગર

ભાવનગર શહેરમાં બોગસ બિલિંગ અંતર્ગત સ્થાનિક વિભાગને અંધારામાં રાખી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના દરોડા દરમિયાન બોગસ બિલિંગ સાથે સંકળાયેલા કેટલાક સ્થાનિક લોકોએ જીએસટીના અધિકારીઓને તમામ માહિતી આપી દેતા બોગસ બિલિંગ કરતા મોટા માથાઓ મુશ્કેલીમાં મુકાયા હતા, તેમજ અંદર ગ્રાઉન્ડ થઈ ગયા હતા. સાંઠગાંઠ કરી બોગસ બિલિંગ કરનાર બીજી ગંગની માહિતી અધિકારીઓને આપી દેનાર વ્યક્તિ તરફ રોષ

જાગ્યો છે. ત્યારે આગામી સમયમાં અમુદે મારામારી કે ગેંગવોર થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારના વીઆઈપી ડેલાઓમાં સ્ટેટ જીએસટી વિભાગની ટીમો દ્વારા વહેલી સવારથી શરૂ કરાયેલ કામગીરીના કારણે કુંભારવાડા, મોતી તળાવ, અને વીઆઈપીના ડેલાઓના વેપારીઓ એ પોતાના ધંધા રોજગાર બંધ જ રાખ્યા હતા અને એકપણ વેપારીએ તરફ દેખાયો ન હતો. જીએસટી વિભાગે આખો દિવસ આમથી તેમ ગાડીઓ દોડાવ્યે રાખી છતાં કોઈ ખાસ હાથ નહોતું લાગ્યું.



First Flight
FFCL Couriers Inc.

કુનીયાના કોઈપણ
દેશમાં ડોક્યુમેન્ટ્સ
અને પાર્સલ મોકલવા
માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા
માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$6 11 LB \$55 વધુ દર LB ના \$6 23 KG \$185, વધુ દર KG ના \$10 30 KG \$230, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>
---	--

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની
હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

<p>Brampton (West) 519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, Opposite Vegetables Market. Phone 647-761-1317, 647-657-9631 -----: MON-THU : ----- 2.00 PM to 6.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p>Scarborough WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-TUE : ----- 2.00 PM to 6.00 PM : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p>Mississauga 2960 Drew Road, Unit-158, Mississauga ON L4T 0A5 Great Punjab Plaza, Next to Malton Gurudwara. : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 5.00 PM</p>
--	--	--

૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com

દિલીપ કુમારની દુનિયાને અલવિદા

98 વર્ષીય દિલીપ કુમારે ૭મી જુલાઈ ૨૦૨૧ના રોજ મુંબઈની ખારની હિંદુજ હોસ્પિટલમાં સવારે ૭.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ ક્રિયા સાંતાક્રુઝના કબ્રસ્તાલમાં સાંજના પાંચ વાગ્યે પૂરા રાજકીય સન્માનથી કરવામાં આવી હતી. આ સાથે જ તેમના અને સાચરા બાનોના ૫૫ વરસના લગ્નજીવનનો અંત આવી ગયો હતો. તેમને હિંદી સિનેમાં પોતાના યોગદાન માટે પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોના મહામારી પરિસ્થિતિને લઈને કબ્રસ્તાલમાં વધુ ભીડ થવા દેવા આવી નહોતી મોટાભાગના બોલીવૂડ સેલિબ્રિટીઓ તેમ જ રાજકારણીઓ તેમના ઘરે જ પત્ની સાચરાબાનોને આશ્વાસન આપવા ગયા હતા. કબ્રસ્તાલમાં સાચરાબાનોની સાથે દિલીપ કુમારના ખાસ મિત્રો ઉપરાંત શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સુભાષ ઘાઈ પત્ની મુક્તા સાથે જોવા મળ્યા હતા. દિલીપ કુમાર લાંબા સમયથી બીમાર હતા તેમના અવસાનના સમાચારથી બોલીવૂડમાં માતમ છવાઈ ગયો હતો. આજે હિન્દી સિનેમાના એક અધ્યાયનો અંત આવ્યો હતો. બોલીવૂડ અને રાજકીય જગતા લોકોએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.

» ક્લિપ જગતમાં દિલીપ કુમારને એક વિજેન્ડ તરીકે યાદ રખાશે: વડાપ્રધાન મોદી

» ભારતીય ઉપમહાદ્વિપમાં તેમને પસંદ કરવામાં આવતા હતા. તેમનું નિધન એક યુગનો અંત છે. ભારતના દિલમાં દિલિપ

સાહેબ હંમેશા જીવતા રહેશે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

» એક એક્ટર નહીં એક સંસ્થાનો અંત આવ્યો છે: અમિતાભ બચ્ચન

» દિલીપ કુમાર સાથે મે કેટલીક યાદગાર પળો વિતાવી છે એક ટાઈમલેસ એક્ટર અને એક સંસ્થા હતા: અજય દેવગણ

» દુનિયામાં ઘણા હીરો હોઈ શકે છે પણ અમારા જેવા એક્ટર માટે તેઓ જ હિરો હતા: અક્ષય કુમાર

દિલીપ કુમારના પાર્થિવ દેહને ભેટીને સાચરાબાનુ રડી પડ્યા

નવીદિલ્હી: દિલીપ કુમારના નિધન બાદ હવે તેમના પત્ની સાચરાબાનુ એકલા પડી ગયા છે. આમ તો તેમની સાથે તેમના સગા સંબંધીઓ છે પણ દિલીપ કુમાર સાથે જે રીતે સાચરાબાનુ પડછાયાની જેમ રહ્યા હતા તે જોતા એવું લાગે છે કે, સાચરાબાનુ માટે દિલીપ કુમારના નિધનના આઘાતમાંથી બહાર નીકળવાનું પણ મુશ્કેલ હશે. હવે સોશિયલ મીડિયા પર દિલીપ કુમારની અંતિમ યાત્રા પહેલાની એક તસવીર ભારે વાયરલ થઈ રહી છે. જેમાં સાચરા બાનુ દિલીપ કુમારના પાર્થિવ દેહને ભેટીને રડી




રહ્યા છે. આ તસવીર જોનારા પણ દુખ અનુભવી રહ્યા છે. દિલીપ કુમાર અને સાચરા બાનુના દાંપત્યજીવનનું ઉદાહરણ બોલીવૂડમાં આપવામાં આવતું હતું.

બે નિકાહને લીધે ખાન કુટુંબમાં ઉથલપાથલ મચી હતી

પહેલી પત્ની સાચરાને સંતાન ન થતા દિલીપે બાળકની ઈચ્છા પુરી કરવા પાકિસ્તાની બ્યુટી ક્વીન અસ્મા સાથે યુવચાપ લગ્ન કરી લીધા હોવાનું મનાય છે. દિલીપકુમારના બીજા લગ્નના કારણે કુટુંબમાં ઉથલપાથલ મચી ગઈ હતી.

દિલીપ કુમારનું સાચું નામ યુસૂફ ખાન હતું તેમને દિલીપ કુમાર નામ દેવિકા રાનીએ આપ્યું હતું: અશોક કુમારની ભલામણથી પહેલી ફિલ્મ મળી હતી





PayLessTravel
Fly Well ... Pay Less

વિમાની સેવાના બુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ



Call for all your Air Travel Services

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

Call us for the Lowest Fares Coming From India to Canada Also

Please Call 905-281-2627

Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7

Get Updated travel information during COVID time







Tico # 50015262



Travel Industry Council of Ontario

GRAND CENTRAL MIMICO
(South Tower)

Guaranteed Access to this prestigious project.

Located at Royal York Rd & Evans Ave in Etobicoke! Grand Central Mimico will feature direct access to the Mimico GO Station,

Starting from **\$500's**



Nadir Shah MBA
Sales Representative

416.625.3580
nadir.shah@sympatico.ca

CENTURY 21
Regal Realty Inc. Brokerage
Member Broker

4030, Sheppard Ave. East, Toronto,
ON M1S 1S6 T: 416.291.0929 (24/7)
F: 416.291.0984



Not intended to solicit buyers or sellers already under a contract



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણદાણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

સાત રાજ્યોની ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતમાંથી સાત સાંસદોને મંત્રીપદ

મંત્રીમંડળનું વિસ્તરણ : અનેક નિશાનો પાર પડયા

મોદી કેબિનેટમાં બુધવારે સાંજે કરાયેલા ફેરફારોથી રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધી તો મોદી પોતે જ નાના મંત્રી મંડળ સાથે ગુડ ગવર્નન્સની વાતો કરતા હતા. પરંતુ અચાનક જ મંત્રીમંડળને મોટું કરવું પડ્યું. આ સાથે જ કેટલાક જેની જોગીઓ પાસેથી મંત્રાલયો છીનવી લેવાયા છે. આગામી દિવસોમાં આ નિર્ણયોના પ્રત્યાઘાતો પણ પડવાના નક્કી છે. જેઓએ મંત્રાલયો પોતાના કાર્યકાળની અવધિ પહેલા જ ગુમાવવા પડ્યા છે તેમાં ડો. હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ નિશંક, સદાનંદ ગોવડા તથા સંતોષ ગંગવાર જેવા નામ મુખ્ય છે. આ નેતાઓને એક સાથે રાજીનામું આપવું પડશે તેની ભાજપના કોઈ નેતા, સરકારનો મંત્રી કે આમજનતાએ પણ કલ્પના કરી ન હતી. હવે આ નેતાઓ પાસેથી મહત્વનું મંત્રીપદ કેમ છીનવી લેવાયું તેની અટકળો સાથે અનેકવાતો શરુ થઈ ગઈ છે.

આ પ્રધાનોએ પોતાની કામગીરી કરવામાં ક્યાંકને ક્યાંક ચુક કરી છે. કોરોનાની બીજી લહેરને કારણે ભારતમાં સર્જાયેલી અંધાધૂંધીથી મોદી સરકારને માથે કેટલાક સમયથી માછલા ધોવાતા રહ્યા છે. આ જ કોરોનાકાળમાં દેશમાં ઓક્સિજન, દવા તથા ઈન્જેક્શનની અછતથી હજારો લોકો મોતને ભેટ્યા છે. મોદી શાસનમાં આરોગ્ય સુવિધામાં સર્જાયેલી આ ગેરવ્યવસ્થાથી દેશમાં અને દુનિયામાં મોદી સરકારની ટીકાઓ થઈ રહી છે. કોરોનાકાળમાં આરોગ્યની જવાબદારી જેના પર હતી એવા ડો. હર્ષવર્ધન દેશની અપેક્ષાઓ પુરી કરી શક્યા નથી. હર્ષવર્ધન બાદ રવાના કરાયેલા અન્ય મંત્રીઓ સાથે પણ કોઈને કોઈ કારણો જોડાયેલા છે. મંત્રીમંડળના ફેરફારોથી ઘણાને લોટરી લાગી ગઈ છે. અનુરાગ ઠાકુર અને કિરેન રિજિજુ તેમાં મોખરે છે. ઠાકુરને માહિતી અને પ્રસારણ જેવું મોભાદાર અને રિજિજુને કાયદા મંત્રાલય જેવું બહુ મહત્વનું ખાતું મળી ગયું છે. મોદીને રાજકારણીઓ કરતાં અધિકારીઓ પર વધારે વિશ્વાસ અને હેત છે એ વારંવાર સાબિત થયું છે. મંત્રીમંડળમાં જૂના અધિકારીઓનો મોટાપાયે સમાવેશ કરીને મોદીએ એ પક્ષપાત ફરી છતો કર્યો છે. આ ઉપરાંત ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રી બનાવીને મોદીએ 2022ની ચૂંટણી પહેલા દિલ્હીમાં બેઠેલી સરકાર ગુજરાત માટે કૃપાદ્રષ્ટિ રાખનારી હોવાનો સંદેશો આપ્યો છે. કેન્દ્રીય કેબિનેટમાં અત્યારે ગુજરાતમાંથી સાત સાંસદો મંત્રી છે. ગુજરાતને આવું પ્રતિનિધિત્વ કેન્દ્રમાં કદી નહોતું મળ્યું. જો કે આ બધા કરતાં મોદી વાત મોદીએ સહકારિતા મંત્રાલયના નામે બનાવેલું



નવું મંત્રાલય છે. મોટાભાગનાં લોકોને આ મંત્રાલય શું કરાશે એની ખબર નથી. પણ સહકારિતા મંત્રાલય મોદીનો પોલિટિકલ માસ્ટરસ્ટ્રોક છે. આ મંત્રાલયના માધ્યમથી ભાજપનાં મૂળિયાં ઊંડાં કરવાની મોદીની નેમ છે. ભારતમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ જોરદાર છે અને ગામેગામ સુધી ફેલાયેલો છે. મોદીએ ભાજપને મજબૂત કરવા માટે કરવા આ નવું મંત્રાલય ઊભું કર્યું છે. ભાજપના ખીલા કોઈ ઉભેડી જ ના શકે એટલા ઊંડા ઠોકીને ભાજપને કોઈ સત્તામાંથી દૂર કરી જ ના શકે એવી સ્થિતિ સર્જવાની દિશામાં મોદીએ આ પહેલું પગલું ઉઠાવ્યું છે. મોદીનો આ વિચાર રાજકીય રીતે અક્સીર અને અસરકારક સાબિત થશે તેમાં શંકા નથી. પરંતુ મોદીનો આ વિચાર મૌલિક નથી. મોદી કોંગ્રેસને ગાળો આપ્યા કરે છે પણ કોંગ્રેસના રસ્તે જ ચાલે છે. સહકાર દ્વારા સત્તાનો વિચાર પણ મોદીએ કોંગ્રેસ પાસેથી જ ઉછીનો લીધો છે. ગુજરાતમાં સત્તા સુધી પહોંચવા અને તેને ટકાવી રાખવા માટે અત્યારે પણ મોદી

પ્રાસંગિક
ધવલ શુક્લ

પવાર અને તેમના ભાયાતોનું સહકારી ક્ષેત્ર પર વર્ચસ્વ છે. આ વર્ચસ્વને તોડવું સરળ નથી. શરદ પવાર જેવા નેતા સરળતાથી પોતાનો ગરાસ લૂંટાવા પણ નહીં દે. શાહ પાસે સત્તા છે તેનો ઉપયોગ એ કરવાના અને સામે પવાર જેવા નેતાઓ પોતાનું વર્ચસ્વ ટકાવવા પૂરી તાકાત લગાવી દેવાના છે. તેથી આગામી દિવસોમાં યોજનારી ચૂંટણીમાં મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપ અને એનસીપી કે પ્રોદેશિક પક્ષો વચ્ચે જોરદાર ટક્કર નિશ્ચિત છે. ટૂંકમાં હવે સહકારી ક્ષેત્ર પણ રાજકીય જંગનો અખાડો બનશે.

હવે વાત ફરી મુદ્દાની કરીએ તો મંત્રીમંડળમાં ફેરફાર અને તેના વિસ્તરણ સાથે મોદીએ એવો મેસેજ આપ્યો છે કે, તમારું નામ ગમે એવું મોટું હોય પણ તમારું કામ જો સારું નહીં હોય તો તમને કોઈ સ્થાન મળવાનું નથી. મોદીએ જે રીતના ફેરફારો કર્યા છે એનાથી સરકાર ઉપર તેમની પકડ વધુ મજબૂત થઈ છે. જેમની કામગીરી સારી રહી છે તેને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે. ભાજપ આમ પણ પહેલેથી કોર્પોરેટ કંપનીની માફક કામ

હર્ષવર્ધન જેવા જૂના જોગીઓ પાસેથી મંત્રાલયો છીનવીને મોદીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો કે સરકારમાં ટકવું હશે તો શ્રેષ્ઠ કામગીરી કરીને જ બતાવવી પડશે

અને ભાજપ આ જ રસ્તો અપનાવી રહ્યા છે. એટલે આજે ગુજરાતના સહકારી વિભાગમાં ભાજપનો દબદબો છે.

જો કે, દેશનાં તમામ રાજ્યોમાં એ સ્થિતિ નથી. ઘણાં રાજ્યોમાં તો મોદીને ટક્કર આપે એવા ધુરંધરો સહકારી ક્ષેત્રમાં અડિંગો જમાવીને બેઠા છે. મહારાષ્ટ્ર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મહારાષ્ટ્રમાં શરદ

કરતું આવ્યું છે. તમારી જાતને પ્રૂવ કરો અને યોગ્ય બદલો મેળવો. જો કે, અનિવાર્ય કિસ્સામાં આ મુદ્દે બાંધછોડ કરવી પડી છે. બિહારની લોકજનશક્તિ પાર્ટીના પશુપતિ કુમાર પારસ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારથી જ નક્કી હતું કે, તેમને કેન્દ્રના પ્રધાન મંડળમાં સમાવશે.

આસામના મુખ્યમંત્રીપદેથી સર્વાનંદ સોનોવાલને હટાવીને હિમંતા બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવવાયા ત્યારથી જ સોનોવાલ કેન્દ્રમાં પ્રધાન બનાવવાની ચર્ચા ચાલી રહી હતી.

હવે નવા પ્રધાનોને એવી સૂચના આપી દેવામાં આવી હતી કે, બને ત્યાં સુધી મીડિયાથી દૂર રહેજો. નવા ચહેરામાંથી કોઈએ એવો અણસાર સુદ્ધા આવવા દીધો નહોતો કે મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવવાનો છે. શપથ લઈ લીધા પછી પણ કોઈ મીડિયા સામે આવ્યું નહોતું. ખાતાની ફળવણી વિશે પણ કોઈએ કંઈ જ ટિપ્પણી કરી નહોતી. ગુરૂવારે સવારે નવા મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો એ પછી કેટલાંક પ્રધાનોએ મીડિયા સાથે ટૂંકી વાત કરી અને વડાપ્રધાનનો આભાર માનતી ટ્વીટ કરી. ભાજપમાં બધાને ખબર છે કે, વધુ પડતા ડાહ્યા થવામાં માલ નથી. આપણને જે કામ સોંપવામાં આવ્યું છે એ કરી બતાવીશું તો જ ટકી શકાશે. આ વિસ્તરણ સાથે મોદીએ એક સાથે અનેક નિશાન પાર પાડ્યા છે. આવતા વર્ષે ૨૦૨૨માં દેશના સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સાત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને મણિપુર સામેલ છે.

સાતમાંથી પંજાબને બાદ કરતા બાકીના રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે અને ગુજરાત મોડલને આગળ ધરીને ભાજપે મોટાભાગના વિસ્તારોમાં કબજો જમાવ્યો છે. તેથી વિસ્તરણમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશના પ્રધાનોની સંખ્યા સાત થઈ છે. ભાજપના સાથી પક્ષ અપના દળના અનુપ્રિયાને પણ જગ્યા મળી છે. આ વખતે કેન્દ્રમાં ગુજરાતને જેટલું પ્રાધાન્ય મળ્યું છે. 60 વર્ષમાં પહેલી વખત પ્રધાન મંડળમાં નવ ટકા જગ્યા મળી છે. મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરાની પસંદગી પાછળ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી જ મુખ્ય બાબત છે. આ વખતે પણ પટેલ ફેક્ટરને બખૂબી બેલેન્સ કરવામાં આવ્યું છે. ભાજપે પોતાના સાથી પક્ષોને પણ આ વખતે ભાજપે સાચવી લીધા છે. ભાજપની સરકાર જ્યારે બીજી વખત આવી ત્યારે સાથીપક્ષોને પ્રધાન મંડળમાં એક-એક સ્થાન આપવાનું નક્કી થયું હતું. એ વખતે જેડીયુના નીતીશ કુમાર નારાજ થયા હતા. એક જ આપવું હોય તો અમારે કંઈ નથી જોઈતું એવું કહીને જેડીયુ સરકારમાં જોડાયું નહોતું.



SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES



CANADA IMMIGRATION

Specialized in :

Entrepreneur/Investor Business/
Self Employed/Farm Owner



AMI MEHTA

IMMIGRATION PRACTITIONER

**BUSINESS IMMIGRATION
TO CANADA REQUIRES
3 CR NET WORTH/
1.5 CR INVESTMENT/
BUSINESS OWNERSHIP/
MANAGEMENT EXP**

**REJECTED
CASES WELCOME**

**ONLINE IELTS
SPOKEN ENGLISH
CLASSES ON ZOOM**

- LMIA/WORK PERMIT
- EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- FEDERAL SKILLED WORKER/SKILLED TRADE
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS
- DETENTION REVIEWS
- CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS

**SUPER VISA INSURANCE / TRAVEL INSURANCE
/ PR 90 DAYS INSURANCE**

94- 499 MAIN STREET SOUTH, SHOPPERS
WORLD MALL, BRAMPTON, ONT

**416-745-2466
905-230-7855**

101-102 SIDDHARTH COMPLEX, BESIDES
EXPRESS HOTEL, ALKAPURI, VADODRA-390007

**91-9428973911
91-9512157817**

Email.: info@siis.ca

Website.: www.siis.ca



ઘરેલું ઉપચાર કરીને તમારી સ્કીનને બનાવો વધુ આકર્ષક

ભાગમદોડ ભરેલી લાઇફ અને અનિયમત ખાનપાનથી ચહેરાની રંગત બાલો ઓછી થઇ જાય છે. જ્યારે યુવક હોય કે યુવતી દરેક લોકોને સુંદર ત્વચા જોઈએ છે. પરંતુ ઘૂળ-માટી અને પ્રદુષણ ભરેલા માહોલને લઇને ચહેરા પર ખીલ થઇ જાય છે. જેને હટાવવા અને ગોરી ત્વચા માટે બ્યુટી પ્રોડક્ટ્સ નો સહારો લે છે. તો આવો જોઈએ રસોડામાં જ રહેલા છે ઘણાં એવા નુસ્ખા. જેનાથી તમારી ત્વચા પણ બની જશે ચાંતોચાંતો ગોરી.

દહીંથી મેળવો ગોરી ત્વચા

દહીંમાં ઘણાં એવા ગુણ હોય છે જે તમારા પાચન તંત્રની સાથે તમારા ચહેરા પર રંગત પણ લાવે છે. દહીંમાં બ્લીચિંગ એજન્ટ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. દહીંમાં થોડોક ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટ 15 મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરો ધોઈ લો. આમ કરવાથી તમારી ત્વચા સુંદર લાગશે.

ત્વચા પર ચમક લાવે છે લીંબુ

લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સી ત્વચા માટે સૌથી સારો ગુણ છે. જેનાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થવાની સાથે ચમક પણ આવે છે. લીંબુના રસને તમે ફેસપેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો. તે સિવાય લીંબુના રસમાં કાકડીનો રસ અને થોડીક હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો મળે છે.

ટેનિંગને દૂર કરે છે ટામેટું

ચહેરા માટે ટામેટાંનું માસ્ક ખૂબ સારું છે. ટામેટાના માસ્કને તમે મધ સાથે ટ્રાય કરી શકો છો. ટામેટા અને મધનું મિશ્રણ ચહેરાની સુંદરતાને ઘણી હદ સુધી વધારે છે. આ માસ્કને



બનાવવા માટે 1 નાનું ટામેટું, 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવો. એક બાઉલમાં ટામેટાંનું પલ્પ લો અને તેની સાથે મધ તેમજ લીંબુ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. આશરે 15 મિનિટ સુકાયા બાદ ચહેરો બરાબર ધોઈ લો. ચહેરા પર ગ્લો લાવવાની સાથે જ આ ઉપાય ચહેરાના દાગ-ધબ્બાને પણ દૂર કરે છે.

ત્વચા માટે બેસ્ટ છે એલોવેરા

એલોવેરા ખાવાની સાથે જ તમે ચહેરા પર પણ લગાવી શકો છો. એલોવેરાનું ગર લગાવવાથી ઘણાં ફાયદા થાય છે. એલોવેરા ચહેરાની સુંદરતાની સાથે સાથે વાળની લંબાઈ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલોવેરા જેલને ચહેરા પર લગાવો અને થોડીક વાર બાદ ધોઈ લો. થોડાક સમય બાદ આમ કરવાથી તમને પણ ફરક જોવા મળશે.

ગિટહબ એ પોતાનું કો-પાયલોટ લોન્ચ કર્યું



ગિટહબ જે એક જાણીતી સોફ્ટવેર ડેવલોપમેન્ટ વેબસાઈટ છે. જેમાં ઘણા સોફ્ટવેરને લગતા સોર્સ કોડ ઉપલબ્ધ છે. જે ડેવલોપર્સ માટે મહત્વનું અને ઉપયોગી પ્લેટફોર્મ છે. ગિટહબ એ AI (આર્ટિફિસીયલ ઇન્ટેલીજન્સ) સાથે પ્રોગ્રામિંગ ટૂલનું અવલોકન શરૂ કર્યું. આ ટૂલ ડેવલોપર્સને પાયથોન, જાવાસ્ક્રીપ્ટ, ગો, રૂબી અને ટાઈપસ્ક્રિપ્ટ જેવી વિવિધ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કોડ લખવામાં મદદરૂપ બનશે.

કો-પાયલોટ, કોડ સિન્થેસાઈઝર તરીકે ઓળખાય છે. જે OpenAI અને CodeXના સહયોગથી બનાવવામાં આવ્યું છે. જે ડેવલોપર્સ દ્વારા લખવામાં આવેલ કોડ અને કોમેન્ટ્સને જાહેરમાં ઉપલબ્ધ હોય એવા કોડ અને કુદરતી ભાષા સાથે સરખાવીને સંપૂર્ણ કોડ બનાવી સ્પિનપેટ્રસમાં રજૂ કરે છે. ગિટહબ કો-પાયલોટ તમે જે કોડ પર કામ કરી રહ્યાં છો તેમાં તમને સજેશન આપે છે. જેથી તમારે આખી લાઈન ટાઈપ કરવાની જરૂર નથી.

ગિટહબના CEO નેટ ફાઈડમેન જણાવે છે કે એક ડેવલોપર માટે ઇન્ટરનેટ પર પોતાના કોડ સંબંધિત સવાલોના જવાબ શોધવા કંટાળાજનક અને વધુ સમય લેનારી પ્રક્રિયા છે. જે હવે AI દ્વારા સરળતાથી શોધી શકાશે અને કોડ લખવામાં ઘણું મદદરૂપ થશે. ગિટહબ કો-પાયલોટ દ્વારા સૂચવેલા કોડ અન્ય કોઈ કોડની જેમ કાળજીપૂર્વક પરીક્ષણ કરે છે. પરંતુ જો ડેવલોપર્સને તેમાં કોઈ ખામી જણાય તો ડેવલોપર ગિટહબની ટીમને જાણ કરી શકે છે જેથી ભવિષ્યમાં કોડ લખવામાં કોઈ મુશ્કેલી ન પડે. ગિટહબની ટીમ દ્વારા આ ટૂલમાં ઓટો-ફિલ્ડ, ઓન ટાઈમ વેરિફિકેશન અને કોડ સજેશન જેવી સેવાને આવરી લેવામાં આવી છે.

ગિટહબ કો-પાયલોટ હાલમાં લોકલી માર્ફકોસોફ્ટના કોસ પ્લેટફોર્મ કોડ એડીટર વિઝ્યુઅલ સ્ટુડિયોના એક્સ્ટેન્શન તરીકે અને ગિટહબના કોડસ્પેસીસ પર ઉપલબ્ધ છે.

@beinghumanmj

શું તમે પણ શ્યામ અંડરઆર્મ્સથી પરેશાન છો, તો કરો આ ઉપાય

કેટલીક મહિલાઓ અંડરઆર્મ્સ શ્યામ થવાના કારણથી સ્કીવલેસ કપડાં પહેરી શકતી નથી. કેટલાક લોકોને તો અંડરઆર્મ્સ બાળપણથી જ શ્યામ હોય છે તો કોઈને ઉંમર વધવાની સાથે થાય છે. તો આવો જોઈએ કેટલાક એવા ઘરેલું નુસખા જેનાથી તમે ઘરે બેસીને જ આ પરેશાનીથી છૂટકારો મેળવી શકો છો.

■ પહેલાના સમયમાં ચણાના લોટનો ઉપયોગ સુંદરતા માટે કરવામાં આવતો હતો. તમે ઈચ્છો તો અંડરઆર્મ્સથી કાળાશ દૂર કરવા માટે તમે ચણાનો લોટ, લીંબુ અને મધનો પેક બનાવીને લગાવી શકો છો. તેના માટે તમે બે ચમચી ચણાનો લોટ અને તેમા થોડોક લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તૈયાર પેસ્ટને

તમે અંડરઆર્મ્સ પર લગાવી શકો છો. 10 મિનિટ બાદ નવશેકા પાણીથી તેને સાફ કરી લો. અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરવાથી શ્યામ અંડરઆર્મ્સની સમસ્યાથી રાહત મળી શકે છે.

■ અંડરઆર્મ્સની કાળાશને દૂર કરવા માટે દૂધમાં બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટને અંડરઆર્મ્સ પર લગાવી અડધો કલાક બાદ ધોઈ લો. સતત થોડાક દિવસ આ ઉપાય કરવાથી અંડરઆર્મ્સની કાળાશ દૂર થશે.

■ બટેટું એક કુદરતી બ્લીચ છે. રોજ સ્નાન કરતા પહેલા બટેટાના ટૂકડા કટ કરીને અંડરઆર્મ્સ પર રગડો. આમ કરવાથી અંડરઆર્મ્સની કાળાશ દૂર થઈ શકે છે.

DIVINE YOGA

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Gratitude Program

Every Thursday 9 PM

કથા, હવન, ગાયત્રી યજ્ઞ,
વાસ્તુ પૂજન, શાહશાંતિ,

કાલસપ્તે યોગ શાંતિ, નક્ષત્ર શાંતિ,
વગેરે ધાર્મિક કાર્યો અને લગ્ન,
બેબી શાવર, જેવા કાર્યો માટે
સંપર્ક કરો.

Shashikant Bhatt

Home: 905-456-7622
Cell: 416-258-2750

Join today on ZOOM!

: Classes Available :
One to One Individual
and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta

કથા, હવન, ગાયત્રી યજ્ઞ,
વાસ્તુ પૂજન, શાહશાંતિ,

કથા, હવન, ગાયત્રી યજ્ઞ,
વાસ્તુ પૂજન, શાહશાંતિ,

કાલસપ્તે યોગ શાંતિ, નક્ષત્ર શાંતિ,
વગેરે ધાર્મિક કાર્યો અને લગ્ન,
બેબી શાવર, જેવા કાર્યો માટે
સંપર્ક કરો.

Shashikant Bhatt

Home: 905-456-7622
Cell: 416-258-2750

Join today on ZOOM!

: Classes Available :
One to One Individual
and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta

ગુજરાતમાં દરરોજ સરેરાશ 267 અકસ્માત : મહિનામાં 30%નો વધારો

પ્રતિ કલાકે સરેરાશ 11 માર્ગ અકસ્માત : 6 માસમાં અકસ્માતની 53,000થી વધુ ઘટના

અમદાવાદ

અનલોકની સાથે જ ગુજરાતમાં જનજીવન ફરી પૂર્વવત્ ધબકવા લાગ્યું છે. એકતરફ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે ત્યાં હવે માર્ગ અકસ્માતના પ્રમાણમાં પણ વધારો થવા લાગ્યો છે. ગુજરાતમાં એક મહિનામાં જ માર્ગ અકસ્માતમાં 30%નો વધારો થયો છે. હાલ રાજ્યમાં માર્ગઅકસ્માત માટે દરરોજના સરેરાશ 267 કેસ સામે આવે છે. આમ, રાજ્યના માર્ગ પર પ્રતિ કલાકે સરેરાશ 11 માર્ગ

અકસ્માત થઈ રહ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસ પીક પર હતા ત્યારે ઈમરજન્સી સેવા '૧૦૮' પાસે એપ્રિલમાં ૫૩૨૨ અને મે મહિનામાં ૬૪૪૪ કોલ્સ આવ્યા હતા. આમ, એપ્રિલમાં દરરોજના સરેરાશ ૧૭૨ અને મે મહિનામાં દરરોજના સરેરાશ ૨૦૮ કોલ્સ આવતા હતા. જેની સરખામણીએ મે મહિનામાં આવતા કોલ્સ વધીને ૮૦૧૪ થયા છે. આમ, કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે માર્ગ

અકસ્માતમાં વધારો થવા લાગ્યો છે. આ અંગે '૧૦૮'ના એક અધિકારીએ જણાવ્યું કે, 'હાલમાં અમારે ત્યાં આવતા કોરોનાના કોલ્સમાં ઘટાડો થયો છે. હાલમાં સમગ્ર રાજ્યમાંથી કોરોનાના દર્દી માટે દરરોજના સરેરાશ ૨૫થી ૩૦ કોલ્સ આવે છે. જેની સરખામણીએ હવે અકસ્માતના કોલ્સમાં વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂન એમ ૬ માસમાં માર્ગ અકસ્માતના કુલ ૫૩,૪૪૪ કોલ્સ આવેલા છે.

૩ રથ, ૫ વાહન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી

અમદાવાદ

કોરોનાના કેસમાં થઈ રહેલા સતત ઘટાડા વચ્ચે સરકારે આ વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા માટે મંજૂરી આપી દીધી છે. જોકે, આ વર્ષે નીકળનારી ૧૪૪મી રથયાત્રામાં માત્ર પાંચ વાહનો અને ત્રણ રથ સિવાય બીજું કંઈ નહીં હોય. ૨૪ કિમી જેટલા લાંબા રુટને આ રથયાત્રા ૪-૫ કલાકમાં જ ક્વર કરીને નિજ મંદિર પરત ફરશે. આ વખતે સરકારે રથયાત્રાની શોભા સમાન ગણાતા હાથી, ભજન મંડળી તેમજ અખાડાને ભાગ લેવાની મનાઈ ફરમાવી દીધી છે. આ મામલે જાણકારી આપતા ગૃહરાજ્ય

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલા યોજાનારી મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે. જે વિસ્તારોમાંથી રથયાત્રા નીકળવાની છે, તે વિસ્તારોમાં આવતા પોલીસ સ્ટેશનોની હદમાં સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી કંટ્રોલ પાલન કરાવવામાં આવશે. આ ઉપરાંત, જે ખલાસીભાઈઓ રથ ખેંચવાના છે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે, અને તેમના માટે વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવાનું પણ ફરજિયાત કરાયું છે. આ વખતે સરસપુરમાં ભક્તોને બપોરનું ભોજન પણ નહીં કરાવાય.

મોરવા હડફના BJP MLAને HCનું સમન્સ, ચૂંટણી રદ કરવા પિટિશન

અમદાવાદ

પંચમહાલ જિલ્લાના મોરવા-હડફના ધારાસભ્ય નિમીષા સુથાર અને ચૂંટણી પંચને હાઈકોર્ટે સમન્સ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. મોરવા હડફથી પેટાચૂંટણીમાં નિમીષા સુથારે અનુસૂચિત જનજાતિ (શિડયુલ્ડ ટ્રાઈબ)નું ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યો હોવાનો આક્ષેપ કરતી ઈલેક્શન પિટિશન કોંગ્રેસના પરાજીત ઉમેદવાર સુરેશ કટારાએ આ પિટિશન કરી છે. કેસની વધુ સુનાવણી બીજી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. કોંગ્રેસના પરાજીત ઉમેદવારે ઈલેક્શન પિટિશનમાં રજૂઆત કરી

છે કે જાન્યુઆરીમાં ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું અવસાન થતાં મે મહિનામાં મોરવા હડફ બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી અને આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. ભાજપના ઉમેદવાર તરીકે નિમીષા સુથારે પેટાચૂંટણી માટે જ્યારે જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું ત્યારે પણ તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી કે આ ઉમેદવાર અનુસૂચિત જનજાતિના નથી અને તેમને આપવામાં આવેલું પ્રમાણપત્ર ખોટું અને ચકાસણી વગરનું છે. આમ છતાં ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી કરી નહોતી.

કોર્ટ કેસોની કાર્યવાહીમાં વિલંબ કરનારા અધિકારીઓ સામે હવે કાર્યવાહી કરાશે

સુપ્રીમ અને હાઈકોર્ટ દ્વારા કેટલાક કેસોમાં અપીલ કાઢી નાખી દેવા આદેશ આપ્યા

અમદાવાદ

ગુજરાત સકારના વિવિધ વિભાગો તેમજ સરકારી કચેરીઓ મારફતે વિવિધ અદાલતોમાં દાખલ થતાં કેસો અને અપીલમાં સમયમર્યાદાનું પાલન નહીં કરનારી જિલ્લા કલેક્ટર કચેરી જવાબદાર રહેશે અને કસૂરવાર અધિકારી કે કર્મચારી સામે શિસ્તભંગના કડક પગલાં લેવાશે. આવો એક આદેશ રાજ્યના મહેસૂલ વિભાગે જારી કર્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આદેશમાં જણાવ્યું છે



કે કોર્ટ કેસોમાં અપીલ દાખલ કરવા માટે સમય મર્યાદા નિયત કરવામાં આવેલી છે. એટલું જ નહીં આ બાબતોમાં નોડલ ઓફિસરની નિયુક્તિ કરી અદાલતી પ્રકરણોમાં યોગ્ય

ટેમ્પરેબ થાય તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી છે પરંતુ તેનું પાલન થતું હોતું નથી. આવા કેટલાક કિસ્સામાં વિલંબ થતાં સરકારને અદાલતોની ફિટકાર સહન કરવી પડતી હોય છે. અદાલતોમાં દાખલ થતાં કેસોમાં હાથ ધરવાની કાર્યવાહી અંગે વિધિસરની સૂચનાઓ આપવામાં આવેલી છે તેમ છતાં કેટલાક અધિકારી કે કર્મચારીઓ દ્વારા કસૂર થતી હોવાનું ધ્યાને આવ્યું છે તેથી આ આદેશ કરવાની ફરજ પડી છે.

રાજ્યમાં મહિલા સશક્તિકરણના દાવા પોકળ, દર બે દિવસે એક બાળલગ્ન

અમદાવાદ

એક બાજુ લોકો કોરોના મહામારીથી પરેશાન છે. ત્યારે બીજી બાજુ કોરોના સમયમાં લોકડાઉન વચ્ચે પણ બાળલગ્નના બનાવો બન્યા છે. રાજ્યમાં કોરોનાના 15 મહિનામાં 261 જેટલા બાળ લગ્નના કિસ્સાઓ 181 હેલ્પલાઈનની સામે આવ્યા છે. કોરોનામાં લોકો પરેશાન હતા. લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ હતા. અનેક પ્રતિબંધો હોવા છતાં વિકાસની વાતો અને મહિલા

સશક્તિકરણના દાવા વચ્ચે બાળ લગ્નના બનાવો વધ્યા છે. 6 વર્ષમાં 1 હજાર 68 જેટલા બાળલગ્નના બનાવો 181 મહિલાઓ માટેની હેલ્પલાઈનમાં સામે આવ્યા છે. અને તેમાં પણ વર્ષ 2020ના જાન્યુઆરી મહિનાથી જૂન 2021 સુધીના કોરોના સમયગાળામાં 261 જેટલા બાળલગ્નના કિસ્સા સામે આવ્યા છે. એટલે કે કોરોનાના સમયમાં દર બે દિવસે રાજ્યમાંથી 1 બાળ લગ્નનો બનાવ સામે આવ્યો છે.

રાજકારણથી લઈને બોલીવુડ સુધી તમામ જગ્યાએ મહિલાઓને સ્થાન અને પ્રતિષ્ઠા મળી છે. એક બાળ લગ્ન છે. આમ તો મહિલાઓ લગ્ન માટે 18 વર્ષની ઉંમર છે. તેમ છતાં વર્ષો જતા જૂની સામાજિક પરંપરાના કારણે બાળ લગ્નના કેસો ગુજરાતમાં વધી રહ્યા છે. મહિલાઓ માટે શરૂ કરેલી 181 અભયમના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં દર વર્ષે 175 જેટલા બાળ લગ્નના બનાવો સામે આવે છે.

ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને મળી જશે હવે નવા પ્રદેશ પ્રભારી

ગાંધીનગર

મિશન ૨૦૨૨ને ધ્યાને રાખીને ભાજપના નવા પ્રદેશ પ્રભારીની ઝડપથી જાહેરાત થઈ શકે છે. વર્તમાન પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળતા ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રભારી મળશે તે નિશ્ચિત છે. કારણકે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. નવા પ્રભારી તરીકે મહત્વના ત્રણ નામોની અટકળો ચાલી રહી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રભારી ઓમ માથુર, વર્તમાન સહપ્રભારી સુધીર ગુપ્તા અને પ્રકાશ જાવડેકરના નામ મુખ્ય છે. ઓમ માથુર

આ પહેલા પણ ગુજરાતના પ્રભારી અને ચૂંટણી પ્રભારી રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતના સંગઠન અને સરકારના મોટાભાગના ચહેરાઓ સાથે પરિચિત છે. તેવામાં તેમની પસંદગીની અટકળો લાગી રહી છે. જો કે આ અંગેનો નિર્ણય તો પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ કરશે. ભૂપેન્દ્ર યાદવ વર્ષ ૨૦૧૭થી ગુજરાત ભાજપના પ્રભારી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ખૂબ જ વિશ્વાસુ માનવામાં આવે છે. અમિત શાહ જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે યાદવને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી.

ધ વર્લ્ડ એકેડમી ઓફ સાયન્સના ફેલો તરીકે ડૉ. પંકજ જોશીનું સન્માન

અમદાવાદ : ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસેટ તરીકે ફરજ બજાવતા ડૉ.પંકજ જોશીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા 'ધ વર્લ્ડ એકેડમી ઓફ સાયન્સ'માં ફેલો તરીકે પસંદગી કરાઈ છે. આ સન્માન મેળવનાર મૂળ ભાવનગરના અને ભારતના એક માત્ર વૈજ્ઞાનિક છે. યુનેસ્કોના નેજા હેઠળની આ વિજ્ઞાન સંસ્થા વિશ્વભરના વિવિધ વિષયના તજજ્ઞા વૈજ્ઞાનિકોની તેમના વિજ્ઞાનમાં રહેલા પ્રદાનને આધારે પસંદગી કરે છે. ડૉ.પંકજ જોશીનું સ્પેસ સાયન્સ અને બ્લેકહોલ પર મોટું સંશોધન છે. તેઓએ મહાકાવ્ય તારાઓમાં ગુરુત્વીય સંકોચન બાદ બ્લેકહોલ કે સિંગ્યુલારિટી બને તેનો અભ્યાસ કરીને સ્પેસ સાયન્સ ક્ષેત્રે નવી દ્રષ્ટિ આપી છે.

પત્નીનું કારસ્તાન: પતિને વતન મોકલી તેનું ડેથ સર્ટિ. બનાવી દીધું વીમા પોલીસીના 8 લાખ રૂપિયા મેળવી લીધા હતા

અમદાવાદ

પતિ પાસે કોઈ કામ ધંધો ન રહેતાં પત્નીએ એક શખસ સાથે મળીને પતિ સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા મેળવવાનું કાવતરું રચ્યું હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ છે. આ મામલે પતિએ જ્યારે પત્ની તથા અજાણ્યા વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા આરોપીએ તેના પતિને મધ્યપ્રદેશ ખાતે મોકલી દીધો હતો અને બાદમાં પતિનું ખોટું ડેથ સર્ટિફિકેટ

બનાવડાવી વીમા પોલીસીના આઠેક લાખ રૂપિયા મેળવી લીધા હતા અને બાદમાં ઘરમાંથી કાઢી મૂકતા પતિ રોડ ઉપર રહેવા મજબૂર બન્યો હતો. સમગ્ર બાબતને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મુળ મધ્યપ્રદેશના અને હાલ નરોડામાં રહેતા ૪૮ વર્ષીય નિમેષભાઈ મરાઠી તેમના ભાઈ સાથે છેલ્લા બે મહિનાથી રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની નંદા છે જે હાલ ઘરકામ કરે છે. નિમેષભાઈને બે દીકરીઓ પણ છે.

આત્મહત્યા નિવારણની રાષ્ટ્રીય નીતિ ઘડવાની પીઆઈએલ ફગાવાઈ

અમદાવાદ

દેશમાં આત્મહત્યા નિવારણની રાષ્ટ્રીય નીતિ અને વ્યૂહરચના બનાવવાની માગણી કરતી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. અરજદારની રજૂઆત હતી કે દેશમાં દર વર્ષે ૧.૩૮ લોકો આત્મહત્યા કરે છે અને ૨૦ લાખ લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે. કોર્ટે અરજદારને યોગ્ય ફોરમ કે સત્તાતંત્ર સમક્ષ રજૂઆત કરવાવાનું કહી રિટ ફગાવી છે. અરજદારની રજૂઆત હતી કે એક વ્યક્તિ આત્મહત્યા કરે ત્યારે તેની સાથે જોડાયેલા ઓછામાં ઓછાં પાંચ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ મેન્ટ હેલ્થ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.



ત્રીજી લહેર પહેલા સરકાર સતર્ક : રાજ્યમાં રોજ 60 હજાર RT-PCR ટેસ્ટ કરવા ટાર્ગેટ

અમદાવાદમાં 8 હજાર, સુરતમાં 7500, રાજકોટમાં 2000, વડોદરામાં 3000નો લક્ષ્યાંક

અમદાવાદ

ગુજરાતમાં કોરોનાની ગતિ મંદ પડતા જ ફરી લોકો બિનદાસ બન્યા છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરતાં નથી. જોકે, વૈજ્ઞાનિકો-તબીબોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે ત્યારે ગુજરાત આરોગ્ય વિભાગ અત્યારથી જ સતર્ક બન્યું છે. ગુજરાતમાં રોજ 60 હજાર આરટીપીસીઆર ઉપરાંત એન્ટીજન ટેસ્ટ કરવા ટાર્ગેટ અપાયો છે પણ માત્ર 20-22 હજાર ટેસ્ટ કરવામાં

આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાએ હળવા પગલે વિદાય લીધી છે.

ગુજરાત અનલોક થયું છે. હાલમાં રોજ કોરોનાના 100થી ય ઓછા કેસો નોંધાઈ રહ્યાં છે. એક સમયે કોરોનાનો ટેસ્ટ કરાવવા લોકોની લાંબી કતારો લાગતી હતી. સામાન્ય ખાંસી, શરદી, તાવમાં ય લોકો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા દોડી જતા હતાં. હવે આ બધું ભૂલાયું છે.

રાજ્ય આરોગ્ય વિભાગે ગુજરાતમાં રોજ 60 હજાર કોરોનાના ટેસ્ટ

કરવા નક્કી કર્યું છે. એટલું જ નહીં, અમદાવાદ સહિત મુખ્ય શહેરો ઉપરાંત જિલ્લામાં નિર્ધારિત સંખ્યામાં ટેસ્ટ કરવા લક્ષ્યાંક અપાયો છે. જેમ કે, અમદાવાદમાં રોજ 8 હજાર, સુરતમાં 7500, વડોદરામાં 3 હજાર, ભાવનગરમાં 1500, જામનગરમાં 1200, રાજકોટમાં 2 હજાર, ગાંધીનગરમાં 750 ટેસ્ટ કરવા નક્કી કરાયું છે. જોકે, કોરોના ટેસ્ટ માટે ટાર્ગેટ અપાયો છે તેના કરતાં ય ઓછા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતમાં 50 ટકાથી વધુ લોકોનું વેક્સિનેશન થયું : સરકારનો દાવો

અમદાવાદ

ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની ગતિમાં ફરી વધારો કરાયો છે. રવિવારના દિવસમાં વધુ 2,65,547 વ્યક્તિએ કોરોના રસી લીધી હતી. વેક્સિન લેવા માટે માન્ય એવી 18થી વધુ વયજૂથની વસતી ગુજરાતમાં 4.89 કરોડ છે.

જેની સરખામણીએ અત્યારસુધી 2.68 કરોડ વ્યક્તિ કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચૂકી છે. આમ, ગુજરાતમાં વેક્સિન લેવા માટે માન્યતા ધરાવતી અડધોઅડધ વ્યક્તિ કોરોના રસીના કવચથી સલામત છે. ગુજરાતમાંથી રવિવારે

18થી 45ના વયજૂથમાં પ્રથમ ડોઝ લેનારા 1.39 લાખ, 45થી વધુ વયમાં પ્રથમ ડોઝ લેનારા 44506, હેલ્થ વર્કર-ફ્રન્ટ લાઈન વર્કરમાં બીજો ડોઝ લેનારા 6626, 18-45 વયજૂથમાં બીજો ડોઝ લેનારા 5586, હેલ્થ વર્કર-ફ્રન્ટ લાઈન વર્કરમાં પ્રથમ ડોઝ લેનારા 200 હતા. રાજ્યમાં અત્યારસુધી 18થી 44ના વયજૂથમાં 1.06 કરોડ, 45-60 વયજૂથમાં 89.97 લાખ, 60થી વધુની વયજૂથમાં 72.05 લાખ વ્યક્તિ કોરોના વેક્સિન લઈ ચૂક્યા છે. રાજ્યમાં મહિલાઓની સરખામણીએ પુરૂષોમાં વેક્સિન લેવાનું પ્રમાણ 12%થી વધુ છે.

કાકીને આપઘાત કરવા મજબૂર કરનાર ભત્રીજાને સાત વર્ષની કેદ નડિયાદમાં કોર્ટે સજા સાથે આરોપીને ઇન્ડ પાણ ફટકાર્યો

નડિયાદ

નડિયાદ સેશન્સ કોર્ટે કાકીને ત્રાસ આપી આત્મહત્યા કરવા વિવશ કરનાર ભત્રીજાને સાત વરસની કેદ અને ઇન્ડ ફટકાર્યો છે. શારીરિક-માનસિક હેરાનગતિ કરી બળજબરીપૂર્વક શરીરસંબંધ બાંધતા ભત્રીજાના ત્રાસથી 2019માં કાકીએ કેરોસીન છાંટી અગ્નિસમાધિ લીધી હતી. મરણજનાર દિકરીના લગ્ન કપડવંજ ખાતે રહેતા સલીમભાઈ સિદ્દિકભાઈ શેખ સાથે થયા હતા. દિકરીને જેઠનો દિકરો એઝાજ અનવરભાઈ ભઠિયારા

લગ્ન બાદ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. વળી પતિ-પત્નિ તરીકેના સંબંધો રાખતો હતો. જો દિકરી સંબંધ બાંધવાનો ના પાડે તો માર મારતો હતો. જેથી દિકરી કંટાળી જઈ પોતાના શરીરે કેરોસિન છાંટીને આગ લગાડી હતી. તે સમયે એઝાજ ત્યા જ ઊભો હતો અને તેને બચાવવાની કોશિશ ન કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આજરોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ મિનેશ આર.પેટેલે કોર્ટમાં ઉગ્ર દલીલો કરી હતી.

ગુજરાતમાં એક જ વર્ષમાં 15 લાખ ગરીબો વધ્યાં, મફત અનાજ લેનારાની સંખ્યા વધી

ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા 3.24 કરોડથી વધીને 3.41 કરોડ થઈ

અમદાવાદ : વાયબ્રન્ટ-વિકસીત ગુજરાતમાં ગરીબી વધી છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં 15 લાખ ગરીબો વધ્યાં છે. ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા 3.24 કરોડ હતી તે વધીને 3.41 કરોડ થઈ છે. એનએફએસઆઈ કાર્ડની સંખ્યામાં થતો વધારો જ દર્શાવે છેકે, ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ વધ્યું છે.

કોરોનાકાળમાં રોજનું કમાઈને રોજનું ખાનારાની દશા સૌથી વધુ કફોડી બની હતી. આ સ્થિતિને પગલે



જ કેન્દ્ર સરકારે મફત અનાજ આપવા નક્કી કર્યું હતું. કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-ગુજરાત બ્રાન્ચે માહિતી આપી કે, કેન્દ્ર સરકારની યોજના હેઠળ અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું

છે જેમાં 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા કાર્ડધારકોને આપવામાં આવે છે.

આ સ્કિમ આગામી પાંચ માસ સુધી લંબાવવામાં આવી છે. ખોટા ફિંગરપ્રિન્ટ આધારે ગરીબોનું અનાજ કાળાબજારીયાઓએ સેરવી જાય છે જેની ફરિયાદ મળતાં કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તપાસ કરી રહ્યું છે.

કોરોનાની પ્રથમ લહેર વખતે ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ જીવતા 3.24 કરોડ લોકોએ મફત અનાજ મેળવ્યું હતું.

ગુજરાતમાં 10 કરોડ ચો. મીટર સરકારી જમીનો ઉપર ભૂમાફિયાઓનો કબજો

લેન્ડગ્રેબિંગ એક્ટની કુલ 4,831 ફરિયાદો : અમદાવાદ, સુરતમાં સૌથી વધુ કિસ્સા

અમદાવાદ

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સરકારી અને ખાનગી રીતે જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓ પર હવે કાયદાનો સર્કજો કસાયો છે. ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કર્યો છે. મહેસૂલ વિભાગના મતે, રાજ્યમાં 10 કરોડ ચો. મીટર આર્યાત્ 9742 હેક્ટરથી વધુ જમીન પર ભૂમાફિયાઓએ કબજો કર્યો છે.

મહેસૂલ વિભાગને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કુલ મળીને 4831 ફરિયાદો મળી છે જેના પગલે સરકારી જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં ભૂમાફિયાઓ સક્રિય બન્યાં છે અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે. ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં રૂપાણી સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી બનાવ્યો છે. આ કાયદાને બહોળો

પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મહેસૂલ વિભાગે પણ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી નિદોષ જમીન માલિકોને જમીન પરત મળે તે માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે.

સૂત્રોના મતે, રાજ્યના જુદા જુદા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓ સામે કુલ 241 પોલીસ ફરિયાદો નોંધાઈ છે. અત્યાર સુધીમાં 96 કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 53 કેસો સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાયા છે.

અમદાવાદમાં રાજકીય દાવપેચમાં 8 મહિનાથી વર્લ્ડ બેંકની લોન અટકી

અમદાવાદ

અમદાવાદ મ્યુનિ.ને વર્લ્ડ બેંક રૂ. 3000 કરોડની મોટી રકમની સોફ્ટ લોન આપવાના લીધેલાં નિર્ણયને આઠ મહિનાથી પણ વધુ સમયગાળો પસાર થઈ જવા છતાં હજુ સુધી પ્લાનીંગ માટેના કન્સલ્ટન્ટની નિમણુંક પણ રાજકીય હુંસાતુંસી અને વહિવટી તંત્ર-શાસકપક્ષ વચ્ચેના મતભેદના કારણે થઈ શકી નથી, જેના કારણે કંટાળીને વર્લ્ડ બેંક એવી તાકિદ કરી છે કે તા. 30મી નવેમ્બર પહેલાં કામોના વર્ક ઓર્ડર અપાયા જાય તે રીતનું આયોજન કરી નાખો, નહીં તો આ લોન અન્ય શહેરને ફાળવી દઈશું, ત્રણ દરખાસ્તો

કન્સલ્ટન્ટ નિમવા મટેની સ્ટેન્ટિંગ કમિટી સમક્ષ આવી છે. જેમાં બે દરખાસ્તમાં પશ્ચિમ વિસ્તારમાં બે નવા એસટીપી બનાવવા, હયાત એસટીપી-સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સૂચના મુજબ અપગ્રેડેશન કરવું, ગંદા પાણીને રિસાયકલ એ રિયુઝ કરવા ટીટીપી-ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવા, માર્કેટનલીંગ પધ્ધતિથી વરસાદી અને ગંદા પાણીના વાહન માટે ગટર લાઈનો નાખવી, જુની લાઈનોનું રિહેબિલીટેશન કરવું, ખારીકટ કેનાલની કામગીરી કરવી વગેરે કામોના ખર્ચનો અંદાજ ડ્રોઈંગ, ટેન્ડર કરવા કન્સલ્ટન્ટ નિમવાની બાબત રજૂ કરાઈ છે.

સોનગઢમાં ટોળાએ હાઈવે જામ કરી પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ

વ્યારા

વ્યારા : મંગળવારે સોનગઢમાં સુચિત ઝીંક કંપનીની લોક સુનવણી દરમિયાન આદિવાસી સંગઠનોના કાર્યકરોએ વિરોધ કરતા જીપીસીપી દ્વારા સુનાવણી મોકુફ રાખવામાં આવી હતી. કાર્યકરો સુરત-ધુલિયા હાઈવે ઉપર ભીડ સાથે ધરણાં પર બેસી જતાં પોલીસ હાઈવે ખુલ્લો કરવા લોકોને સમજાવવાની કોશિષ કરતી હતી ત્યારે ચક્રમક થતાં ટોળાએ પથ્થરમારો શરૂ કરતા પોલીસે દંડાવાળી કરતા નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં એક ડીવાયએસપી સહિત 5 પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. પોલીસે ટીયરગેસના ૭૦ સેલ છોડ્યા હતા.

સચિવાલયમાં ખેડૂતોનો હલ્લાબોલ, 2.5 કરોડ ચૂકવો નહીતર કોર્ટમાં જશું

2017માં ખરીદેલા રાયડા-મગફળીનાં નાણાં હજુ સરકારે ચૂકવ્યાં નથી

વડગામ

ટેકાના ભાવે ખરીદેલા રાયડા અને મગફળીના નાણાં સરકારે હજુ ચૂકવ્યાં નથી જેના કારણે ખેડૂતો પાટનગર ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યા છે. આજે સચિવાલયના દરવાજે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ એવી ચિમકી ઉચ્ચારી કે, જો સરકાર ખેડૂતોને અઢી કરોડ નહી ચૂકવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું. બનાસકાંઠાના ખેડૂતો સરકારમાં રજૂઆત કરવા આવ્યા હતાં.

રાષ્ટ્રીય કિસાન સંઘના આગેવાનોનું કહેવું હતું કે, વર્ષ 2017માં નાગરિક પુરવઠા નિગમે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રાયડો અને મગફળીની ખરીદી કરી હતી. બનાસકાંઠાના 245 ખેડૂતોએ રાયડો અને મગફળીનું વેચાણ કર્યું હતું. આ વાતને આજે ત્રણ વર્ષ કરતાં ય વધુ સમય વીતી ચૂક્યો છે ત્યારે હજુ ય સરકારે ખેડૂતોને અઢી કરોડ જેટલી માતબર રકમ ચૂકવી નથી. ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું કે, કાં તો નાણાં આપો, કાં અમારો માલ પરત કરો.

શિક્ષકે વનસ્પતિના બીજના સંરક્ષણ કરી ઇન્ડિયા બુકમાં સ્થાન મેળવ્યું

પાલનપુર

વર્ષ 2021માં કોરોના મહામારીની પ્રથમ લહેરમાં બનાસકાંઠાના દાંતીવાડાના એક શિક્ષકે લોકડાઉનનો સદઉપયોગ કરી દુર્લભ થઈ રહેલી અલગ અલગ જદ્દ જાતની વનસ્પતિના બીજ એકઠા કરી લુપ્ત થઈ રહેલી આર્યુવેદીક સહિતની વનસ્પતિને ફરી જીવંત કરવાનો પ્રયાસ રૂપે બીજબેંક બનાવી હતી. રાજ્યના કોઈ પણ લોકોને આ દુર્લભ વનસ્પતિ જીવંત કરવી હોય તેઓને નિ:શુલ્ક પોસ્ટ મારફેતે બીજ મોકલવામાં આવતા આ વનસ્પતિ પ્રેમી શિક્ષકને ઇન્ડિયા બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ શિક્ષકના અનોખા કાર્યને જોઈ અન્ય પ્રકૃતિ પ્રેમીઓ પણ પ્રભાવિત થયા હતા.



કલાકારની વિદાયની ભારત-પાક.માં ગમગીની

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરીફ આલ્વી તથા PM ઈમરાન ખાને શ્રદ્ધાંજલિ અર્પી

દિલીપકુમારના આ ફિલ્મી કિરદારો જે હંમેશાને માટે ચાહકોને યાદ રહેશે

- દાગ : આ ફિલ્મમાં દિલીપકુમારે શંકર નામના યુવાનોનો રોલ કર્યો હતો. દાગ માટે દિલીપકુમારને પોતાની કારિયરનો પ્રથમ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો.
- દેવદાસ : ૧૯૫૫માં શરદચંદ્ર ચટોપાધ્યાયના દેવદાસ ઉપન્યાસ પર આધારિત દેવદાસ ફિલ્મમાં દિલીપકુમારના કિરદારને લોકો આજે પણ ભૂલ્યા નથી.
- આઝાદ : ઈસ ૧૯૫૫માં શ્રીરામુલુ નાયડુ નિર્દેશિત ફિલ્મમાં આઝાદનો શિર્ષક રોલ કર્યો હતો.
- નયા દૌર : આઝાદની પુષ્કભૂમિ પર બનેલી કેટલીક ફિલ્મોમાં નયા દૌર ખૂબજ સશક્ત ફિલ્મ હતી. નયા દૌરની કથા વાર્તા અને ગીતો આજે પણ સંગીતપ્રેમીઓ સાંભળે છે.
- મોગલે આઝમ : ૧૯૬૦માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં દિલીપકુમારે અકબરના પુત્ર શહજાદે સલીમના પાત્રનો અભિનય કર્યો હતો.
- કોહિનૂર : ફિલ્મોમાં સતત દર્દ ભરેલા પરેશાન પાત્રોનો અભિનય કરીને ટ્રેજેડી કિંગ ગણાનારા દિલીપકુમારના અંગત જીવન પર પણ તેની અસર થવા લાગી હતી. આથી દિલીપકુમારને કોમેડી રોલ કરવાની સલાહ આપવામાં આવી હતી.

મુંબઈ : ટ્રેજેડી કિંગ દિલીપકુમારના નિધનથી પાકિસ્તાનમાં તેમના અગણિત ચાહકોમાં શોકની લાગણી ફરી વળી હતી. પહેલાં અખંડ હિન્દુસ્તાનના એક ભાગ અને વિભાજન પછી પાકિસ્તાનમાં સામેલ પેશાવરના ખૈબર પખ્તુન્વા પ્રાંતમાં જન્મેલા યુસુફ ખાન ઉર્ફે દિલીપકુમારને શ્રદ્ધાંજલી આપતા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરીફ આલ્વીએ જણાવ્યું હતું કે દિલીપકુમારના ઈન્તેકાલના સમાચાર જાણી આઘાત લાગ્યો છે. તેઓ એક શાનદાર કલાકાર અને વિનમ્ર ઈન્સાન હતા. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ જણાવ્યું હતું કે યુસુફખાન સાહેબના નિધનથી ભારત અને પાકિસ્તાનના કરોડો લોકોને આઘાત લાગ્યો છે. આ મહાન કલાકાર સહુના હૃદયમાં કાયમ હયાત રહેશે. વડાપ્રધાન ઈમરાનખાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, કેન્સર હોસ્પિટલ માટે કરેલી મદદ હંમેશા યાદ રહેશે.

નાની બહેનને છોડીને જતા રહ્યા યુસુફભાઈ, લતા મંગેશકરે આપી શબ્દાંજલિ



લતા મંગેશકરે દિલિપ કુમારની સાથેની પોતાની તસવીર શર કરતા લખ્યું છે કે, યુસુફ ભાઈ પોતાની નાની બહેને છોડીને જતા રહ્યા. યુસુફ ભાઈ ગયા છે અને એક યુગનો અંત આવ્યો છે.

દેવ-દિલીપ-રાજની ત્રિપુટી




૧૯૫૦ના દાયકાના ત્રણે ટોચના કલાકારો દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદ જિગરી દોસ્તો હતા. ત્રણે અવારનવાર એકબીજાને મળતા અને એકમેકની ફિલ્મોની વાતો કરતા. દાદાસાહેબ ફાળકે એવોર્ડ લેવી જતી વખતે રાજકપૂર બીમાર પડી જતા કોમામાં સરી પડ્યા હતા. દિલીપ કુમાર પણ દિલ્હી પહોંચી ગયા હતા.

૬ દાયકામાં માત્ર ૬૩ ફિલ્મો કરી અમિત છાપ છોડી

દિલીપકુમાર તેમની કારિયરમાં મોગલે આઝમ એક માત્ર ફિલ્મ જેમાં મુસ્લિમ પાત્ર ભજવ્યું હતું. દિલીપકુમારે તેમની ૬ દાયકાની ફિલ્મ કારકિર્દીમાં માત્ર ૬૩ ફિલ્મોમાં જ કામ કરીને અમિત છાપ છોડી છે. અભિનય માટે તેમના જેવું સમર્પણ ભાગ્યેજ કોઈ કલાકારમાં જોવા મળે છે.

દિલીપકુમાર એક મહાન કલાકાર અને માનવતાના પ્રતિક હતા : કાસીમ અબ્બાસ

મિસીસાગા : કેનેડાના મિસીસાગા ખાતે રહેતા કાસીમ અબ્બાસે બોલીવુડ કલાકાર દિલીપકુમારના નિધન અંગે કહ્યું હતું કે, દિલીપકુમારમાં કલાકારી સાથે માનવતાના ભાવના ખૂબ હતી. ૧૯૭૪માં અને તે પછી ૧૯૭૭માં મારી (કાસીમભાઈ)ને અબુ ઝહબીમાં દિલીપકુમાર સાથે મુલાકાત થઈ હતી. દિલીપ કુમારે સિનેમા હોલમાં સ્ટેજ પર બહુ જ ભાવુક થઈને શ્રોતાઓનો આભાર માન્યો હતો. ૧૯૭૭માં અબુ ઝહબીમાં તેઓ હિલ્ટન હોટલમાં રોકાયા હતા, ૧૯૭૪ અને ૧૯૭૭માં તેમની સાથે થયેલી મુલાકાતમાં તેમની નિખાલસતાનો અનુભવ થયો હતો. આટલા મહાન કલાકાર હોવા છતાં બનાવટ કે દેખાવ ન હતો. તેઓએ અમારી સાથે ખુલ્લા દીલે વાતચીત કરી હતી. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે એવી દુઆ કરીએ છીએ.



કલાસીફાઈડ / Classified

A COUPLE OR SINGLE PERSON NEEDED FOR HOUSEKEEPING
A couple or a single person needed for housekeeping jobs in Longlac (Northern Ontario). Please contact Amit at 519 590 5410 or feneloninn@yahoo.com

HIRING
Couple or 2 Students Required Full Time for Subway & Gas Station at Deep River, ON. Help will be Provided in PR Process Contact :-Ph. 613-852-1510

બેઝમેન્ટ ભાડેથી આપવાનો છે.
(કીલ-લોરેન્સમાં)
કીલ-લોરેન્સ ઈન્ટરસેક્શન ખાતે સંપૂર્ણ રીનોવેટેડ અને વોકઆઉટ બેઝમેન્ટ ભાડેથી આપવાનો છે જે તમામ ઉપકરણોથી સજ્જ. બધી બેંકોથી વોકોબલ ડીસ્ક્રેન્સ, ટીવીસી/મેટ્રો/વોલમાર્ટ/કલીનિક અને અન્ય સ્ટોર્સથી પણ નજીક. સ્ટુડન્ટસને પહેલી તક આપાશે.
સંપર્ક કરો :- ૪૧૬-૮૨૫-૪૭૧૪ or Email :-basil_daniel@yahoo.ca. વહેલા તે પહેલાના ધોરણે

હોરર ફિલ્મો માટે જાણીતા રામસે બ્રધર્સ પૈકીના કુમાર રામસેનુ નિધન

હોરર ફિલ્મો માટે જાણીતા રામસે બ્રધર્સ પૈકીના કુમાર રામસેનુ હાર્ટ એટેકથી નિધન થયુ છે. તેઓ ૪૬ વર્ષના હતા. કુમાર રામસેના મોટા પુત્રે કહ્યુ હતુ કે, આજે તેમણે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. રામસે ભાઈઓમાં કુમાર ઉપરાંત કેશુ, તુલસી, કરણ, શ્યામ, ગંગુ અને અર્જુન સામેલ હતા. ૭૦ અને ૮૦ના દાયકામાં આ ભાઈઓ હોરર ફિલ્મોના નિર્માણથી જાણીતા થયા હતા. ઓછા બજેટની આ ફિલ્મોનો એક આગવો ચાહક વર્ગ હતો. કુમાર રામસે ફિલ્મોની સ્ક્રિપ્ટ લખવામાં મહત્વની ભૂમિકા અદા કરતા હતા. જેમાં પુરાના મંદિર, સાયા અને ખોજ જેવી ફિલ્મો સામેલ છે. સાયા ફિલ્મમાં શત્રુઘ્ન સિંહા લીડ રોલમાં હતા જ્યારે ૧૯૮૯માં રિલિઝ થયેલી ખોજ ફિલ્મમાં રુષી કપૂર અને નસરુદીન મુખ્ય રોલમાં હતા.

શું માનવીના કર્મોનો બોજો કોઈ બીજો ઉપાડી શકશે ?

કુરાન મજહદમાંના ચાર એવા બોધવચનો નીચે આપવામાં આવે છે, જેમાં બહુ જ સ્પષ્ટ રીતે એ કહેવામાં આવેલ છે કે જે પણ માનવી સદ્કાર્યો કરશે કે નહારા કાર્યો કરશે, તે કેવળ તેના પોતાના માટે જ કરશે એટલે કે પોતાના જ લાભાર્થે કરશે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કાર્યો કરનારના કર્મોનો બોજો(ભાર) કેવળ કાર્ય કરનારના જ શીરે રહેશે અને અંતિમ બદલા(કયામત) ના દિવસે કોઈ માનવી પોતાના કર્મોના બોજા સિવાય કોઈ અન્યના કર્મોનો બોજો કદાપિ નહીં ઉઠાવે, ભલે તે તેનો બહુ જ નજીકનો સગોસંબંધી થતો હોય. અને બોજો ઉઠાવનાર કોઈ અન્ય માનવીને સાદ પણ દેશે તો પણ તે અન્ય માનવી તેની સહાયે નહીં આવે. આ ચાર બોધવચનો આ પ્રમાણે છે :-



મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજહદના બોધવચનો પર આધારિત

- “જેણે કોઈ સદ્કાર્ય કર્યું, તો તે સદ્કાર્ય તેણે પોતાના માટે જ કર્યું. અને જેણે નહારૂ કાર્ય કર્યું, તો તેના આ નહારા કાર્યનો બોજો(ભાર) તેની ઉપર જ હશે. અને તમારો પાલનહાર અલ્લાહ પોતાના ભક્તો(બંદાઓ) પર જુલ્મ કરનાર નથી.”(પ્રકરણ ૪૧, શ્લોક ૪૬)
- “અને બદલા(કયામત)ના દિવસે પોતાના કર્મોનો બોજો ઉપાડનાર કોઈ બીજાના કર્મોનો બોજો નહીં ઉપાડે. અને જો કોઈ કર્મોના બોજાથી લદાયેલી વ્યક્તિ કોઈ અન્યને પોતાના કર્મોનો બોજો ઉપાડવા માટે પોકારશે, તો તેના કર્મોના બોજામાં થી થોડોક ભાગ પણ ઉપાડવા માટે અન્ય કોઈ નહીં આવે, પછી ભલે તે તેનો નિકટનો સગો જ કેમ ન હોય.” (પ્રકરણ ૩૫, શ્લોક ૧૮)
- “કોઈ કર્મોનો બોજો ઉપાડનાર કોઈ અન્યનો બોજો બદલા (કયામત)ના દિવસે નહીં ઉપાડે. છેવટે તમને સૌને પોતાના પાલનહાર અલ્લાહની તરફ પાછા ફરવાનું છે. પછી તે તમને બતાવી દેશે કે તમે શું કાર્યો કરતા રહ્યા છો. તે તો દિલોમાંની હાલત સુધ્ધાં સંપૂર્ણ રીતે જાણે છે.” (પ્રકરણ ૩૮, શ્લોક ૭)
- “તે અંતિમ બદલા (કયામત)ના દિવસે લોકો જુદા જુદા ટોળામાં થઈ જશે, જેથી તેમને તેમના કર્મોની વિગત (આમાલનામા) બતાવવામાં આવશે અને તેનો બદલો પણ. પછી જેણે રજ ભાર પણ ભલાઈ (નેકી) કરેલ હશે,

તે તેને જોઈ લેશે. અને જેણે રજ ભાર પણ પાપ (બદી) કરેલ હશે, તે પણ તેને જોઈ લેશે.(પ્રકરણ ૯૯, શ્લોક ૬, ૭ અને ૮)

કર્મોના આ હિસાબ-કિતાબ અને બદલાના અંતિમ (કયામત ના) દિવસે અપાનારા તેના બદલા વિષે કુરાન મજહદમાં એક જગ્યાએ પાલનહાર અલ્લાહે જીવન અને મૃત્યુનું શા માટે સર્જન કરેલ છે, તે વિષે કહેવામાં આવેલ છે. આ વિષેનું બોધવચન આ પ્રમાણે છે :-

“અત્યંત મહાન અને ઉચ્ચતર છે તે હસ્તી, જેના હાથમાં સમસ્ત સૃષ્ટિનું રાજ્ય છે, અને તે દરેક વસ્તુ પર શક્તિમાન છે, જેણે મૃત્યુ અને જીવનનું સર્જન કર્યું, જેથી તે તમને અજમાવી જુએ કે તમારામાંથી કોણ સદ્કાર્યો (આમાલે સ્વાલેહ) કરાનારાઓ છે.” (પ્રકરણ ૬૭, શ્લોક ૧ અને ૨)

ઉપરના બોધવચન અનુસાર પાલનહાર અલ્લાહે તેના સર્જન કરેલા માનવીઓને આ જગતમાં જીવન

આપીને મોકલેલ છે, તેનો એક જ ઉદ્દેશ છે કે તે અજમાવે કે તેના સર્જેલા માનવીઓ માંથી કોણ તેના આદેશો અનુસાર સદ્કાર્યો કરનારાઓ છે. અને આ સદ્કાર્યો કરનારાઓ અથવા નહારા કાર્યો કરનારાઓ પોતાના કાર્યો માટે કેવળ તેઓ પોતે જ પાલનહાર અલ્લાહ પાસે જવાબદાર છે, અને ન કે તેમના બદલે કોઈ અન્ય માનવી. બીજા શબ્દોમાં તેમના કર્મોનો બોજો કેવળ તેઓને પોતાને જ ઉપાડવો પડશે.

આ વિષે એક પ્રશ્ન એ પણ ઉત્પન્ન થાય છે કે બદલાના અંતિમ (કયામતના) દિવસે જ્યારે દરેક માનવીના કર્મોનો હિસાબ કિતાબ થશે, ત્યારે જેમના કુકર્મોનું પાસું તેના સુકર્મો કરતા વધારે ભારી હશે, તેમના માટે કોઈ ભક્તિભાવવાળી, ધાર્મિક, કર્તવ્યનિષ્ઠ અને આદરણિય વ્યક્તિ (પાલનહાર અલ્લાહના વલી-દોસ્ત સમાન) તરફથી ભલામણ સ્વીકારવામાં આવશે કે કેમ ? આ પ્રશ્નનો ઉત્તર આપણને કુરાન મજહદ માંથી મળી જાય

ઈસ્લામની આરસી
કાસિમ અબ્બાસ



કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ: 43 મંત્રીનાં શપથ

નવીદિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીજી ટર્મની સરકારમાં ૪૩ ચહેરાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરાયા હતાં. બુધવારે સાંજે ૬ કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેબિનેટ કક્ષાના ૧૫ અને રાજ્યકક્ષાના ૨૮ મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. જેમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પ્રમોશન મેળવનાર ૭ વર્તમાન મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. સાદા શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ

પંકજ ચૌધરી	ભાજપ	ઉત્તરપ્રદેશ
અનુપ્રિયા પટેલ	અપના દલ	ઉત્તરપ્રદેશ
ડો. સત્યપાલ સિંહ બઘેલ	ભાજપ	ઉત્તરપ્રદેશ
રાજીવ ચંદ્રશેખર	ભાજપ	કર્ણાટક
શોભા કરાન્ડલજે	ભાજપ	કર્ણાટક
ભાનુપ્રતાપ સિંહ વર્મા	ભાજપ	ઉત્તરપ્રદેશ
દર્શના વિક્રમ જરદૌસ	ભાજપ	ગુજરાત
મીનાક્ષી લેખી	ભાજપ	દિલ્હી
અન્નપૂર્ણા દેવી	ભાજપ	ઝારખંડ
એ નારાયણ સ્વામી	ભાજપ	કર્ણાટક
કૌશલ કિશોર	ભાજપ	ઉત્તરપ્રદેશ
અજય ભટ્ટ	ભાજપ	ઉત્તરાખંડ
બી એલ વર્મા	ભાજપ	ઉત્તરપ્રદેશ
અજય કુમાર	ભાજપ	ઉત્તરપ્રદેશ
ચૌહાણ દેવુસિંહ	ભાજપ	ગુજરાત
ભગવંત ખુબા	ભાજપ	કર્ણાટક
કપિલ મોદેશ્વર પાટિલ	ભાજપ	મહારાષ્ટ્ર
પ્રતિમા ભૌમિક	ભાજપ	ત્રિપુરા
સુભાષ સરકાર	ભાજપ	પંજાબ
ભાગવત કરાસ	ભાજપ	મહારાષ્ટ્ર
રાજકુમાર રવિન સિંહ	ભાજપ	મહિષુર
ડો. ભારતી પવાર	ભાજપ	મહારાષ્ટ્ર
બિન્દેશ્વર ટુડુ	ભાજપ	ઓડિશા
શાંતનુ ઠાકુર	ભાજપ	પંજાબ
ડો. મુંબાપરા મહેન્દ્રભાઈ	ભાજપ	ગુજરાત
જહોન બાલ્	ભાજપ	પંજાબ
ડો. એલ મુરુગન	ભાજપ	તામિલનાડુ
નિતિશ પ્રમાણિક	ભાજપ	પંજાબ



કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ

■ નારાયણ રાણે - એમએસએમઇ મંત્રાલય ■ સર્નાઈ સોનોવાલ - બંદર-શિપિંગ-જળમાર્ગ મંત્રાલય, આરુપ મંત્રાલય ■ ડો વીરેન્દ્ર કુમાર - સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ■ જ્યોતિરાદિત્ય સિંધિયા - નાગરિક ઉક્ત્યન મંત્રાલય ■ રામચંદ્ર પ્રસાદ સિંહ - પોલાદ મંત્રાલય ■ અશ્વિની વેષ્ણવ - રેલવે મંત્રાલય, કોમ્યુનિકેશન મંત્રાલય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી મંત્રાલય ■ પશુપતિ કુમાર પારસ - ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રાલય ■ ભૂપેન્દ્ર યાદવ - પર્યાવરણ અને વન મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય

કયા રાજ્યને કેટલું પ્રતિનિધિત્વ?

■ ઉત્તર પ્રદેશ ૭ ■ ગુજરાત ૫ ■ મહારાષ્ટ્ર ૪ ■ પંજાબ ૪ ■ કર્ણાટક ૪ ■ બિહાર ૩ ■ મધ્ય પ્રદેશ ૨ ■ ઓડિશા ૨ ■ દિલ્હી ૧ ■ આસામ ૧ ■ અરુણાચલ ૧ ■ મહિષુર ૧ ■ રાજસ્થાન ૧ ■ પંજાબ ૧ ■ તેલંગાણા ૧ ■ હિમાચલ ૧ ■ ઝારખંડ ૧ ■ ઉત્તરાખંડ ૧ ■ ત્રિપુરા ૧ ■ તામિલનાડુ ૧

રાજ્યમાંથી કેબિનેટમાં પ્રમોશન મેળવનારા

■ કિરેન રિજિવુ - કાયદા અને ન્યાય મંત્રાલય ? (અગાઉ- યુવા મામલા અને રમત મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન) ■ રાજકુમાર સિંહ - ઉર્ષા મંત્રાલય સ્વ ન્યુ એન્ડ રિવ્યુએબલ એનર્જી મંત્રાલય ? (અગાઉ- રિવ્યુએબલ એનર્જી મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) ■ હરદીપસિંહ પુરી - પેટ્રોલિયમ મંત્રાલય અને હાઉસિંગ-શહેરી બાબતોનું મંત્રાલય ? (અગાઉ- નાગરિક ઉક્ત્યન અને હાઉસિંગ-શહેરી બાબતોના રાજ્યમંત્રી) ■ મનસુખ માંડવિયા - આરોગ્ય મંત્રાલય અને રસાયણ-ખાતર મંત્રાલય ? (અગાઉ- બંદર અને જહાજરાની - ખાતર અને રસાયણ રાજ્ય મંત્રી, સ્વતંત્ર હવાલો) ■ પરષોત્તમ રૂપાલા - પશુપાલન, મત્સ્ય અને ડેરી મંત્રાલય ? (અગાઉ- કૃષિ રાજ્યમંત્રી) ■ જી કિશન રેડ્ડી - સંસ્કૃતિ મંત્રાલય, પ્રવાસન મંત્રાલય, ઉત્તરપૂર્વ ભારત વિકાસ મંત્રાલય ? (અગાઉ- ગૃહ રાજ્યમંત્રી) ■ અનુરાગ ઠાકુર - માહિતી અને પ્રસારણ મંત્રાલય, યુવા બાબતો અને રમત મંત્રાલય ? (અગાઉ- નાણા અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી)

કયા કયા મંત્રીઓને પડતાં મૂકાયાં...

■ ડો. હર્ષવર્દન - આરોગ્યમંત્રી ■ રમેશ પોખરિયાલ નિશંક - શિક્ષણમંત્રી ■ દેબશ્રી ચૌધરી - મહિલા અને બાળવિકાસમંત્રી ■ સદાનંદ ગોવડા - ખાતર અને રસાયણમંત્રી ■ સંતોષ ગંગવાર - શ્રમમંત્રી ■ સંજય ઘોષ્ટ્રે - શિક્ષણ રાજ્યમંત્રી ■ બાબુલ સુપ્રિયો - વન અને પર્યાવરણમંત્રી ■ પ્રતાપ સાંરંગી - પશુપાલન, ડેરી, મત્સ્ય રાજ્યમંત્રી ■ રતનલાલ કટારિયા - જળશક્તિ રાજ્યમંત્રી ■ થાવરચંદ ગેહલોત - સામાજિક ન્યાય, સશક્તીકરણમંત્રી ■ રવિશંકર પ્રસાદ - કાયદા અને આઈટી મંત્રી ■ પ્રકાશ જાવડેકર - માહિતી અને પ્રસારણ મંત્રી

દેશમાં 7 રાજ્યપાલ બદલાયા : કેન્દ્રીય મંત્રીને પણ રાજ્યપાલનું પદ અપાયું

કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત કર્ણાટકના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળશે

નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપેક્ષિત કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ પૂર્વે સાત રાજ્યપાલોને બદલવામાં આવ્યા હતા. તેમાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આમ ૭૩ વર્ષના થાવરચંદ ગેહલોત હવે કર્ણાટકના રાજ્યપાલ પદનો કાર્યભાર સંભાળશે. તેઓ સામાજિક ન્યાય અને સંપ્રભુત્વ વિભાગના કેન્દ્રીય મંત્રી હતા. આ ઉપરાંત ભાજપના

રાજ્યસભાના નેતા હતા. તેમના જવાના લીધે કેબિનેટની સાથે તેમના રાજ્યસભા પદની પણ જગ્યા પડશે. મિઝોરમના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈ હવે ગોવાના ગવર્નર બનશે. હરિયાણાના ગવર્નર સત્યપાલ નારાયણ આર્યા ત્રિપુરાના ગવર્નર બનશે. ત્રિપુરાના ગવર્નર રમેશ બૈસ ઝારખંડના ગવર્નર બનશે. હિમાચલ પ્રદેશના ગવર્નર બંડારુ દત્તાત્રેય હરિયાણાના ગવર્નર બનશે. હરિયાણા મિઝોરમના

ગવર્નર બનશે. મંગુભાઈ છગનભાઈ પટેલ મધ્યપ્રદેશના ગવર્નર બનશે. રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર હિમાચલ પ્રદેશના ગવર્નર બનશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવી નિમણૂકોની કવાયત બધા વર્ગોની પ્રતિષ્ઠા અને સન્માનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી) હોય તેવા ઘણા ગવર્નર છે.

૮ સપ્તાહમાં ટ્વીટર ફરિયાદ અધિકારીની નિમણૂક કરશે

નવી દિલ્હી

નવા માહિતી ટેકનોલોજી નિયમોને લઈને કેન્દ્ર અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે દિલ્હી હાઈકોર્ટ ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર કોઈ પ્રકારના આઈટી કાયદાનું ઉલ્લંઘન કરે છે તો કેન્દ્ર સરકાર કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. હવે સુનાવણી ૨૮ જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હકીકતમાં અંતરિમ અધિકારીની નિમણૂકને લઈને ટ્વિટરે એફિડેવિડ દાખલ કરી હતી. આ પહેલા ટ્વિટરે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે, તે આઠ સપ્તાહની અંદર ફરિયાદી

અધિકારીની નિમણૂક કરશે. ટ્વિટરે કોર્ટને તે પણ જણાવ્યું કે, તે આઈટી નિયમોનું અનુપાલન માટે ભારતમાં એક સંપર્ક કાર્યાલય સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે. આ કાર્યાલય તેનું સ્થાયી હશે. ટ્વિટરના અંતરિમ નિવાસી ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે ૨૧ જૂને પોતાનું પદ છોડ્યું હતું. બાદ ટ્વિટરે કેલિફોર્નિયા સ્થિત જેરેમી કેરલને ભારત માટે નવા ફરિયાદી અધિકારી નિમણૂક કર્યા હતા, પરંતુ કેસલની નિમણૂક નવા આઈટી નિયમો પ્રમાણે નહોતી, કારણ કે આ નિયમોમાં કહ્યું છે કે ફરિયાદ નિવારણ અધિકારી સહિત બધા નોડલ અધિકારી ભારતમાં હોવા જોઈએ.

હિમાચલ પ્રદેશના પૂર્વ CM વીરભદ્ર સિંહનું 87 વર્ષની ઉંમરે અવસાન

નવી દિલ્હી

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસી નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની ઉંમરે અવસાન થયું છે. લાંબી બીમારી સામે ઝઝૂમ્યા બાદ ગુરુવારે સવારે ૦૩:૪૦ કલાકે તેમણે શિમલા ખાતેની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (આઈજીએમસી)માં અંતિમ શ્વાસ લીધા હતા. વીરભદ્ર સિંહ છેલ્લા 2 મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે કોરોનાને 2 વખત માત આપી હતી. છેલ્લા 2 દિવસથી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી જેથી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેઓ 6 વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા હતા જેના પરથી હિમાચલના રાજકારણમાં તેમનું કદ કેટલું

સુરક્ષાદળોએ અથડામણમાં ૪ આતંકીનો ખાતમો બોલાવ્યો

પુલવામા

દક્ષિણ કાશ્મીરમાં બે અલગ અલગ એકનાઉન્ડરમાં ચાર આતંકીઓ ઠાર થયા છે. પુલવામાના પુછલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ અને ત્યારબાદ સુરક્ષાદળોને મોટી સફળતા મળી. પોલીસને જાણકારી મળી હતી કે પુછલ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા છે અને ત્યારબાદ પોલીસની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોની જોઈન્ટ સર્ચિંગ ટીમે જેવો સંદેશ

સ્પોટને ઘેર્યો કે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાદળોએ પણ જવાબી ફાયરિંગ કર્યું અને ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકીઓને સરન્ડર કરવાની તક પણ અપાઈ પરંતુ તેમણે ના પાડી દીધી. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે આવું જ બીજું ઓપરેશન દક્ષિણ કાશ્મીરના કુલગામમાં પણ ચલાવવામાં આવ્યું હતું જેમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓ માર્યા ગયા. ૪ આતંકીઓ માર્યા ગયા બાદ આ વર્ષે માર્યા ગયેલા કુલ આતંકીઓની સંખ્યા ૭૧ થઈ છે.

કલકત્તામાં જજની નિષ્પક્ષતા સામે શંકા બદલ મમતા બેનર્જીને 5 લાખનો દંડ

કોલકાતા

કલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીને આંચકો આપતા તેમના પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નંદીગ્રામ કેસની સુનાવણી કરતી વખતી વખતે ન્યાયમૂર્તિ કૌશિક ચંદાએ પોતાના પર લાગેલા આરોપોને નિરાધાર ગણાવીને મમતા બેનર્જીને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેઓ આ કેસની સુનાવણીમાંથી ખસી ગયા છે. આ નાણાનો ઉપયોગ કોરોના પીડિત પરિવારોની મદદ માટે કરવામાં આવશે. ન્યાયમૂર્તિ ચંદાએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ રાજકીય પક્ષ માટે હાજર થાય છે તો તે અસામાન્ય છે પણ પરંતુ કેસની સુનાવણી કરતી વખતે તે પોતાના પૂર્વગ્રહનો ત્યાગ કરે છે.

દેશના 174 જિલ્લામાં કોરોનાના નવા સ્વરૂપ મળ્યા

દિલ્હી પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગુજરાતમાંથી કોરોનાના ગંભીર સ્વરૂપના સેમ્પલ મળી આવ્યા

નવી દિલ્હી

કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે રાજધાની દિલ્હી સહિત પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગુજરાતમાંથી કોરોનાના ગંભીર સ્વરૂપના સેમ્પલ મળી આવ્યા છે જે કોરોના સંક્રમણની ગતિને ફરીથી વધારી શકે છે. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ખાસ સતર્ક રહેવા સલાહ આપી છે. હકીકતે દેશભરના 174 જિલ્લાઓમાંથી કોરોનાના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપના સેમ્પલ મળી આવ્યા છે. કોરોનાના આ નવા સ્વરૂપોના કારણે ફરી એક વખત કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય તેવું

જોખમ સર્જાયું છે. એટલું જ નહીં, આ નવું સ્વરૂપ વેક્સિનના ડોઝ લઈ ચુકેલા લોકોને પણ ભરડામાં લઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના 120 કરતા પણ વધારે મ્યુટેશન મળી આવ્યા છે. જોકે તેમાં આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપે સૌથી વધારે અસર દેખાઈ છે. તે સિવાય ડેલ્ટા પ્લસ સ્વરૂપ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. પૂર્વોત્તરના રાજ્યોમાં વધી રહેલા કોરોનાના ગ્રાફને ધ્યાનમાં રાખીને ફરી લોકડાઉન અંગે વિચારણા થઈ શકે છે. અત્યાર સુધીમાં 73 કરતા વધારે જિલ્લાઓમાં સંક્રમણ દર 10 ટકાથી વધારે આવ્યો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45892 લોકો કોરોના સંક્રમિત, 817ના મોત

ભારતમાં કોરોના સંક્રમણનો કહેર ઘટ્યો છે પણ ચિંતાનું કારણ હજુ પણ છે કારણ કે રોજ નોંધાતા કેસો ૪૦ હજારથી ઉપર જ નોંધાય છે, સાથોસાથ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. બીજી તરફ, કોરોના વેક્સીનેશન અભિયાન પણ ચાલી રહ્યું છે. ગુરુવારે ૩૩ લાખ ૮૧ હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૫,૮૯૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૮૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૭,૦૯,૫૫૭ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૬,૪૮,૪૭,૫૪૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વેક્સીનના ૩૩,૮૧,૬૭૧ ડોઝ આપવામાં આવ્યા હતા.

ભીડ વાળા સ્થળે પ્રતિબંધની ચીમકી

નવી દિલ્હી : ભારતમાં છેલ્લા 111 દિવસમાં સૌથી ઓછા કોરોનાના દૈનિક ૩૪૭૦૩ કેસો સામે આવ્યા છે. જ્યારે ત્રણ મહિનામાં સૌથી ઓછા ૫૫૩ લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ કુલ કેસોનો આંકડો ૩૦૬૧૯૯૩૨એ પહોંચી ગયો છે અને કુલ મૃત્યુઆંક પણ વધીને ૪૦૩૨૮૧એ પહોંચ્યો હતો. એસ્ટિવ કેસો ફરી ઘટીને ૪૬૪૩૫૭ રહ્યા હતા જે છેલ્લા ૧૦૧ દિવસમાં સૌથી ઓછા છે.

પૂર્વ મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્નીની વસંત વિહાર ખાતે હત્યા

નવી દિલ્હી

દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્ની કિટ્ટી કુમારમંગલમની મંગળવારે રાતે દિલ્હીના વસંત વિહાર ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે અને અન્ય ૨ આરોપીઓની તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે ૬૭ વર્ષીય કિટ્ટી કુમારમંગલમના ઘરમાં લૂંટના ઈરાદાથી ઘૂસેલા બદમાશોએ તેમની હત્યા કરી દીધી હતી. તેઓ વસંત વિહાર ખાતે આવેલા પોતાના આવાસમાં બીજા માળે રહેતા હતા. કિટ્ટીના પતિ પી. રંગરાજન કુમારમંગલમ અટલ સરકારમાં મંત્રી હતા.

ભારતીય અધિકારીઓના દબાણથી ડોમિનિકામાં ધરપકડ : મેદુલ ચોકસી

નવી દિલ્હી

ભાગેડુ હીરાના વેપારી મેદુલ ચોકસીએ આરોપ લગાવ્યો કે ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ માટે તેમની ધરપકડ ભારત સરકારના પ્રતિનિધિઓના 'કહેવા' પર થઈ છે. તેણે કાર્યવાહી રદ કરવાની માંગણી કરતી રોસીયૂની હાઈકોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે. કેરેબિયન દેશના ઈમીગ્રેશન મંત્રી, તેમના પોલીસ પ્રમુખ, અને કેસના તપાસ અધિકારીની વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. ચોકસી ભારતથી ભાગેડુ થયા બાદ ૨૦૧૮થી એન્ટીગુઆ અને બારબુડામાં રહે છે અને ત્યાંથી ગુમ થઈ

ગયા હતા. ગેરકાયદે પ્રવેશ અંતર્ગત ૨૩મી મેના રોજ પાડોશી દેશ ડોમિનિકામાંથી ધરપકડ કરાઈ હતી. ડોમિનિકાના ઈમિગ્રેશન મંત્રાલયે તેને પ્રતિબંધિત ઈમિગ્રન્ટ જાહેર કરી દીધો. જે પંજાબ નેશનલ બેન્કમાં ૧૩૫૦૦ કરોડ રૂપિયાના ગોટાળાના સંબંધમાં ભાગેડુ છે. હીરાના વેપારીએ ડોમિનિકામાં હાઈકોર્ટનો દરવાજા ખખડાવતા આરોપ મૂક્યો કે રોસીયૂમાં કાર્યવાહક પોલીસ પ્રમુખ લિંકન કોબેટ અને તપાસ અધિકારી સર્જેન્ટ અલીનેનો ગેરકાયદે પ્રવેશ માટે આરોપ મૂકવો 'તેમના સ્વતંત્ર નિર્ણયનું પરિણામ નથી'.

દેશમાં સહકારી ચળવળને પ્રોત્સાહન માટે 'સહકાર મંત્રાલય'ની રચના

નવી દિલ્હી

મોદી સરકારે ઐતિહાસિક પગલું લેતાં 'સંસ્કાર સે સમૃદ્ધિ'ના તેના વિઝનને વાસ્તવિક બનાવવા માટે અલગ 'સહકાર મંત્રાલય'ની રચના કરી છે. આ મંત્રાલયનો આશય દેશમાં સહકારી ચળવળને પ્રોત્સાહન આપવાનો છે. દેશમાં પાયાના સ્તરે લોકો આધારિત ચળવળના મૂળ ઊંડા ઉતરે અને લોકોને લાભ થાય તે માટે આ મંત્રાલયની રચના કરાઈ છે તેમ સૂત્રોનું કહેવું છે. આ મંત્રાલય સહકારી ચળવળને મજબૂત બનાવવા માટે અલગ વહીવટી, કાયદાકીય અને નીતિવિષયક માળખું પૂરું પાડશે. વર્તમાન સમયમાં કો-ઓપરેટિવ આધારિત આર્થિક વિકાસ મોડેલ દેશ માટે ઘણું જ સુસંગત છે.

વાસ્તુશાંતી પૂજા-યજ્ઞ

વેદોક્ત પદ્ધતિથી સંપૂર્ણ વાસ્તુ શાસ્ત્રથી વાસ્તુ શાંતિ પૂજા યજ્ઞ



ઘર પૂજા સ્થાન છે. ઘરમાં જ સ્વર્ગ છે. ઘરમાં જ શાંતિનો આધાર છે. અને ઘરમાંજ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ છે. પરંતુ જો આ બધી શ્રેષ્ઠતા આપનાં ઘરમાં ના હોય તો ઘરનાં કહેવાય તેને નર્ગ કહેવાય તો આપના નવા ઘરને સ્વર્ગ બનાવવા માટે સચોટ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી વાસ્તુશાંતિ યજ્ઞ થવો જરૂરી છે. કારણ કે જ્યારે નવા ભવનનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે તેના ભૂગર્ભમાંથી ખોદકામથી આઠ વસ્તુઓ દોષ યુક્ત નિકળે છે તદઉપરાંત નર-અને પશુના અસ્થિ નિકળવાથી ભૂમિદોષ લાગે છે જેનાથી ઘર સ્વર્ગ નહિ પરંતુ નર્ગ બની સ્મશાન જેવું થઈ જાય છે. આવા અશુભ દોષનાં નિવારણ માટે વાસ્તુ શાંતિ યજ્ઞ કરાવવો.

કથા, વાસ્તુ, બેબીશાવર, ગૃહપ્રવેશ, નવચંડી, લઘુરુદ્ર, રુદ્રી પાઠ, ચંડીપાઠ દરેક પ્રકારના હવન અને પૂજા વિધિ કરાવનાર, જન્માક્ષર બનાવવા તથા જોવડાવવા માટે મળો

શાસ્ત્રી મિલનભાઈ ત્રિવેદી આણંદ (બોરસદ) ગુજરાત વાળા
Mobile : 647 770 5984

॥ શ્રી ગણેશાય નમઃ ॥



'સહ પ્રવેશ'




આપની દરેક સમસ્યાનું સમાધાન સાધના અનુષ્ઠાનથી કરાવવામાં આવશે

સચોટ અને શાસ્ત્રોક્ત જ્યોતિષ સલાહ અને નિદાન-વિધાન



નવા, જનમાક્ષર બનાવવા અને જોવડાવવા, કુંડળીમેળાપ, કાલસર્પદોષ, ગ્રહણદોષ પિતૃદોષ, શનીપનોતી, લગ્નયોગ, મકાન-યોગ, ગુપ્તરોગ, દેવુમુક્તિ, શિગ્રવિવાહ, શિગ્રનોકરી પ્રાપ્તિ, બાળકોના ભણવા માટે વિદ્યા યોગ, વિદેશગમન યોગ તથા આપની કોઈપણ ગુપ્ત સમસ્યા, ગુપ્ત રોગ, ગુપ્ત શત્રુનિવારણ માટે મળો. શું આપના બાળકો પુત્ર-પુત્રી ગલત માર્ગથી પાછા વાળવા માંગો છો, શું આપના ઘર પરિવાર ઉપર કોઈએ મેલી વિદ્યા કરેલ છે, શું આપના ઘરમાં હંમેશા લડાઈ-ઝઘડા થાય છે, શું આપનો ભાગ્યોદય થવામાં વિલંબ થાય છે. શું આપના ઘર પરિવાર ઉપર કોઈક સંમોહન વશીકરણ કરેલ છે. શું આપ હંમેશા કોઈ મોટી બિમારીના શિકાર છો તેનો ઈલાજ કર્યા છતાં પણ તેનું નિવારણ નહિ થતું, શું આપનાં વ્યાપાર ધંધાને લગતી કોઈ સમસ્યા છે તો આવી જીવનની દરેક સમસ્યાનાં નિવારણ માટે આજેજ અમારી મૂલાકાત લો અને સચોટ શાસ્ત્રોક્ત વિધાનથી સમસ્યાનું નિવારણ કરાવો.

દરેક પ્રકારના ગ્રહોના નંગ, યંત્રોગ, સ્ફટિકની માળા, શિવલિંગ, ઘોડાની નાળ, શિયાળાસિંગિ, હથ્થા જોડી, વૈજંતીબિજની માળા, મુંગાની માળા, રુદ્રાક્ષ માળા, મેરુપૃષ્ઠ શ્રી યંત્ર, ગોમતીચક્ર દરેક વસ્તુવિધી કરેલ પ્રાણપ્રતિષ્ઠત વાળી મળશે.






ડેલ્ટા કરતા જોખમી લેમ્બડા વેરિએન્ટની 30 દેશમાં એન્ટ્રી

લેમ્બડા વેરિએન્ટ દક્ષિણ અમેરિકાના પેરુમાં દેખાયો, બ્રિટનમાં પણ કેસ મળતા ફફડાટ ફેલાયો

લંડન

કોરોના વાયરસની ત્રીજી લહેર અને વાયરસના નવા ડેલ્ટા વેરિએન્ટની આશંકા સ્વાસ્થ્ય ક્ષેત્રના જાણકારોને ડરાવી રહી છે ત્યારે હવે કોરોનાનો ડેલ્ટા કરતા પણ ખતરનાક વેરિએન્ટ સામે આવ્યો છે.

લેમ્બડા વેરિએન્ટ નામના આ નવા વેરિએન્ટને ડેલ્ટા કરતા પણ જોખમી ગણાવવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ પ્રમાણે લેમ્બડા વેરિએન્ટ દુનિયાના 30 દેશોમાં જોવા મળી રહ્યો છે. જાણકારોને ચિંતા છે કે, આ વેરિએન્ટ ડેલ્ટા કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. લેમ્બડા વેરિએન્ટ બ્રિટનમાં પણ જોવા મળ્યો છે. સૌથી પહેલા આ વેરિએન્ટ દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોનાથી મોતને ભેટનારાઓની ટકાવારી પેરુમાં સૌથી વધારે છે. મે અને જુનની વચ્ચે આ દેશમાં લેમ્બડા વેરિએન્ટના 82 ટકા નવા કેસ સામે આવ્યા હતા. વધુ એક દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાં પણ મે અને જુનની વચ્ચે 31 ટકા કેસ લેમ્બડા સાથે જોડાયેલા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પહેલા જ લેમ્બડા વેરિએન્ટને વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટના વિસ્તરમાં મુકેલો છે.

યુકેમાં ફરી કોરોનાનું સંક્રમણ, નવા 32548 કેસ નોંધાયા

યુકેમાં ફરી કોરોનાનું સંક્રમણ, નવા 32548 કેસ નોંધાયા

યુકેમાં પાછલા ૨૪ કલાક દરમિયાન કોવિડ-૧૯ના ૩૨,૫૪૮ નવા કેસ નોંધાયા હતા, જે ગયા જાન્યુઆરી પછીનો સૌથી ઊંચો આંક છે. પાછલા કેટલાક દિવસ દરમિયાન નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે કે ગઈકાલની સરખામણીએ મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જે ૩૦થી ઘટીને ૩૩ નોંધાય છે. ડેલ્ટા વેરિએન્ટ હવે અમેરિકામાં ડોમિનન્ટ થઈ ગયો છે, દેશમાં નવા કોવિડ-૧૯ કેસ નોંધાય રહ્યા છે તેમાંથી ૫૦ ટકા કરતાં વધારે કેસ ડેલ્ટા વેરિએન્ટના છે અને મિસૂરી, કેનસાસ સહિત કેટલાંક અમેરિકન રાજ્યોમાં ડેલ્ટાનું સંક્રમણ ૮૦ ટકા જેવા મળે છે. દરમિયાન ગુરુવારે ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટમાં વર્ષના સૌથી વધારે નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા હતાં.

ઓમાને ભારત સહિત 24 દેશોની ફ્લાઇટ રદ કરી

ઓમાને ગુરુવારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત કુલ ૨૪ દેશોની પેસેન્જર ફ્લાઇટને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશો બીજી નોટિસ આપવામાં ના આવે ત્યાં સુધી અમલી રહેશે. યાદીમાં સામેલ અન્ય દેશોમાં યુકે, ટયૂનિશિયા, લેબેનોન, ઇરાન, ઇરાક, લિબિયા, બ્રુનેઈ, સિંગાપોર, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ઇથોપિયા, સુદાન, તાન્ઝાનિયા, સાઉદી આરબ, ઘાના, સિયેરા લિઓને, નાઈજીરિયાનો સમાવેશ થાય છે.

વિશ્વનો શક્તિશાળી પાસપોર્ટ જાપાનનો, ભારત ૯૦મા ક્રમે

લંડન

દુનિયાના સૌથી પાવરફુલ પાસપોર્ટસનું ૨૦૨૧નું વિસ્ત જાહેર થઈ ગયું છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા ૨૦૦૬ થી આ પ્રકારનું રેકિંગ જાહેર કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં જાપાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી પાવરફુલ પાસપોર્ટ જાહેર થયો છે તો ભારતને આ રેકિંગમાં આ વખતે મોટું નુકસાન થયું છે. રેકિંગ જાહેર કરનાર હેનલી એન્ડ પાર્ટનર્સનું કહેવું છે કે, જાપાનનો પાસપોર્ટ દુનિયાના ૧૯૩ દેશોમાં ફી વિઝા અથવા તો વિઝા ઓન એરાર્દવલની સુવિધા આપે

છે. જોકે સંસ્થાએ સ્પષ્ટતા પણ કરી છે કે, કોરોના સંકટના કારણે આ વર્ષે બહુ ઓછા લોકોએ વિદેશોમાં ટ્રાવેલ કર્યું છે અને પહેલા ત્રણ મહિનામાં તો ટુરિઝમની સ્થિતિ આખી દુનિયામાં ખરાબ રહી છે. પાવરફુલ પાસપોર્ટના વિસ્તરમાં સિંગાપુર બીજા નંબરે છે. જેનો પાસપોર્ટ ૧૯૨ દેશમાં વિઝા ઓન એરાર્દવલ અને વિઝા ફી એક્સેસ આપે છે. ૩ સ્થાને ૧૯૧ દેશોના વિઝા ફી એક્સેસ સાથે દક્ષિણ કોરિયા અને જર્મની છે. ૪ ક્રમે ૧૯૦ દેશોની વિઝા ફી એક્સેસ સાથે ફિનલેન્ડ, ઈટાલી અને લક્ઝમબર્ગ તેમજ સ્પેન છે.

રશિયાના પૂર્વ છેડે તૂટી પડેલા વિમાનના તમામ 28 પ્રવાસીઓનાં મોત નીપજ્યા

વિમાનમાં 22 મુસાફરો ઉપરાંત 6 કર્મચારીઓ હતા: પાલાણના મેયરનું મોત

મોસ્કો

બે એન્જિનવાળું એન્ટોનોવ એએન-26 ટર્બોપ્રોપ વિમાન, પ્રાંતીય રાજધાની પેટ્રોપાવ્લોવ્સ્ક કામ ચાટસ્કાયથી કામચાટકા પેનિન્સુલાથી ઉત્તરે આવેલા ગામ પાલાણા ખાતે જઈ રહ્યું હતું ત્યારે એણે એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. ઈન્ટરફેક્સે, સૂત્રોને ટાંકીને જણાવ્યું કે સ્પષ્ટ દેખાતું હોય એવી પરિસ્થિતિમાં ઉતરાણની તૈયારી કરતું વિમાન કોઈ



ખડકમાં તૂટી પડ્યું હોવું જોઈએ. દેશના ઈમરજન્સી મંત્રાલયે ખોવાયેલા વિમાનની તપાસ માટે હેલિકોપ્ટર

અને રાહત-ટુકડીઓ મોકલી એ પછી વિમાન જ્યાં તૂટી પડ્યું એ જગ્યા મળી આવી હતી, એમ રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ કહ્યું હતું. વિમાનમાં 22 પ્રવાસીઓ અને 6 ચાલક - સભ્યો હતા. વિમાનના ગંતવ્ય-સ્થાન પાલાણના મેયર ઓલ્ગા મોખિરેવા પણ વિમાનમાં હતા, એમ સ્થાનિક સત્તાવાળાઓને ટાંકીને તાસ એજન્સીએ કહ્યું. વિમાન ગુમ થયું ત્યારે એ સ્થળે વાદળો વાતાવરણ હતું.

ગૂગલની મુશ્કેલીમાં વધારો : ૩૬ US રાજ્યોએ ગૂગલ સામે કેસ દાખલ કર્યો

વોશિંગ્ટન

અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ગૂગલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. અમેરિકાના ઉટાહ, ન્યૂયોર્ક, નોર્થ કેરોલિના, ટેનેસી તથા કોલમ્બિયા સહિત ૩૬ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીએ ગૂગલ સામે કેસ દાખલ કરીને આરોપ મૂક્યો છે કે સર્ચ એન્જિન કંપની ગૂગલ પ્લે સ્ટોર મારફત એકાધિકારનો દુરુપયોગ કરીને કાયદાનું ઉલ્લંઘન કરે છે. પ્લે સ્ટોરને મેનેજ કરવાની પદ્ધતિથી ગ્રાહકો અને એપ ડેવલપર્સ બંનેને નુકસાન થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ગૂગલ પ્લે

સ્ટોરમાં કેટલીક ખાસ કરાર અને અન્ય સ્પર્ધા વિરોધી વર્તન મારફત ગૂગલે એન્ટ્રોઈડ સાધનનો ઉપયોગ કરતાં લોકોને મજબૂત હરીફાઈથી વંચિત કરી દીધા છે.

આ દાવામાં જણાવાયું છે કે હરીફાઈ વધવાથી યૂઝર્સને વધારે વિકલ્પ મળી શકે છે અને ઈનોવેશનને પણ વેગ મળશે અને સાથે મોબાઈલ એપની કિંમતોમાં પણ ઘટાડો થઈ શકે છે. ન્યૂયોર્કના એટર્ની જનરલ જેમ્સ અને તેમના સાથીઓએ ગૂગલ પર એવો પણ આરોપ મૂક્યો છે કે એપ ડેવલપર્સને પોતાની ડિજિટલ સામગ્રીને ગૂગલ પ્લે

સ્ટોર પર વેચવા મજબૂર કરવામાં આવે છે, એટલું જ નહીં તેના માટે ગૂગલને અનિશ્ચિત સમયગાળા સુધી ૩૦ ટકા કમિશન પણ આપવું પડે છે.

દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક, ટ્વિટ્ટર અને ગૂગલ તથા તેના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, જેક ડોર્સી અને સુંદર પિચાઈ સામે કેસ દાખલ કર્યો છે. અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી બાદ અમેરિકી સંસદ કેપિટોલમાં હિંસાના સંદર્ભમાં આ સોશિયલ મીડિયા કંપનીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને પોતપોતાના પ્લેટફોર્મ પર પ્રતિબંધિત કરી દીધા હતા.

અફઘાનમાં તાલિબાનોનો પ્રભાવ, ભારતીય નાગરિકોને બહાર કઠારો

નવી દિલ્હી

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય સ્વદેશ પરત ફરી રહ્યું છે ત્યારે તાલિબાન આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાલિબાન લડવૈયાઓએ અફઘાનિસ્તાનના અનેક જિલ્લાઓ કબજે કર્યા છે. ભારત સહિત ઘણા દેશો અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિથી ચિંતિત છે. ભારતીય નાગરિકો અફઘાનિસ્તાનના ઘણા શહેરોમાં રહે છે. ભારત સરકારે તેમની સલામતીને લઈને મોટો નિર્ણય લીધો છે. મિડિયા રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનમાં તાલિબાનોના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને, ભારત તેના અધિકારીઓ અને

નાગરિકોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે અફઘાનિસ્તાનના કાબુલ, કંદહાર અને મઝાર-એ-શરીફ શહેરોમાં રહેતા આપણા કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓને બહાર કાઢવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિને જોતા, ઘણા દેશો દૂતાવાસો અને કોન્સ્યુલેટ ચલાવવામાં અસમર્થ બની રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે તાલિબાનના હુમલાના ડરથી અફઘાન અધિકારીઓએ જ તેમની સરકારના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી ભાગવાનું શરૂ કર્યું છે.

સિંગાપોરમાં ભારતીયને ઓઈલની ચોરી બદલ સાડા છ વર્ષની સજા

શંઘાઈ

સિંગાપોર: રોયલ ડચ શેલની સિંગાપોર ખાતેની રિફાઈનરીમાંથી 2017-18માં 15 કરોડ ડોલરનાનું ૩ લાખ ટન ગેસ ઓઈલ ચોરનારા ભારતીય મૂળના વ્યક્તિ અને તેના મલેશિયન સહયોગીને છ વર્ષ કરતા વધારે સમયની સજા થઈ છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. રોયલ ડચ શેલની સિંગાપોર રિફાઈનરીમાંથી ઓઈલની ચોરી કરવા બદલ ભારતીય મૂળના 40 વર્ષના સદાગોપન પ્રેમનાથને છ વર્ષ અને આઠ મહિનાની અને તેના મલય સહયોગી 39 વર્ષના મુહમ્મદ અશરફ હમઝાને સાડા નવ વર્ષની સજા થઈ હતી. શેલની સિંગાપોર ખાતેની રિફાઈનરી તેની સૌથી મોટી રિફાઈનરી મનાય આવે છે.

બિટકોઈન બે હજાર ડોલર વધ્યા, બ્રાઝીલમાં 30 કરોડ ડોલરનો ફોડ

રિયો-ડી-જાનેરો

ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે મંદીનો આંચકો પચાવી ભાવ ફરી વધી આવ્યા હતા. બજારભાવ જાતવાર દોઢથી સાડા ત્રણ ટકા ઉચકાયા હતા. બિટકોઈનમાં ઘટાડો બાઈંગ જોવા મળ્યું હતું. વિશ્વબજારમાં ફૂડટેલના ભાવમાં રેકોર્ડ તેજ આવતાં તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉચેથી નીચે ઉતરતાં ક્રિપ્ટો કરન્સીના ભાવ ફરી ઉચકાયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે બ્રાઝીલમાં 30 કરોડ ડોલરનો બિટકોઈનનો નવો ફોડ પ્રકાશમાં આવતા ક્રિપ્ટો બજારમાં ભાવ ભલે ઉચકાયા છતાં



અંદર ખાને બજારમાં ગભરાટ પણ જણાઈ રહ્યો હતો. દરમિયાન, બિટકોઈનના ભાવ આજે નીચામાં 33158થી 33159 ડોલર થયા પછી ઉચામાં ભાવ 35106થી 35107 ડોલર થઈ 34106થી 34107 ડોલર રહ્યા હતા.

હૈતી દેશના રાષ્ટ્રપતિ જોવેનલ મોઈસીની ઘરમાં ઘૂસીને હત્યા કરાઈ

પોર્ટ-ઓ-પ્રિસ

કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનલ મોઈસીની તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર તેમના ઘરમાં જ કમાન્ડોના એક સમૂહ દ્વારા રાષ્ટ્રપતિ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ અંગે હૈતીના વચગાળાના વડાપ્રધાન ક્લોડ જોસેફે જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે વહેલી સવારે બની હતી જેમાં સ્પનીશમાં વાત કરી રહેલા કેટલાક અજ્ઞાત લોકોએ રાષ્ટ્રપતિના ખાનગી નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો અને હેડ ઓફ સ્ટેટને જીવલેણ ઈજા પહોંચાડીને ઘાયલ કરી દીધા હતા જેમાં તેઓનું મોત થયું હતું. રાષ્ટ્રપતિના પત્ની મોઈસીને પણ ગોળી લાગી હતી પરંતુ તેઓનો જીવ બચી ગયો છે.

ઇંગ્લેન્ડ 55 વર્ષ બાદ ફાઇનલમાં



લંડન

ઇંગ્લેન્ડ ફરીથી ફૂટબોલ ચેમ્પિયન બને તેવી સંભાવનાઓ વધી ગઈ છે. ૫૫ વર્ષની લાંબી રાહ જોવાનો પ્રથમ તબક્કો પૂરો થઈ ચૂક્યો છે અને હવે સ્વપ્ન સાકાર કરવા માટે ઇંગ્લેન્ડને થોડાક દિવસ વધુ રાહ જોવી પડશે. ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં ડેનમાર્કને

૨-૧થી હરાવીને યુરો કપ ૨૦૨૦ ફૂટબોલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેનો મુકાબલો પરંપરાગત હરીફ ઈટાલી સામે થશે જેણે પ્રથમસેમિફાઇનલમાં સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી પરાજય આપ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ છેલ્લે ૧૯૬૬માં પ્રથમ તથા છેલ્લી વખત

કોઈ મેજર ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશી હતી. ટીમના વિજયનો સ્ટાર સુકાની હેરી કેન રહ્યો હતો જેણે ટીમના બંને ગોલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે રમાનારી ફાઇનલ મુકાબલામાં પોતાના ઘરઆંગણાના પ્રેક્ષકોની વચ્ચે રમવું ઇંગ્લેન્ડ માટે આસાન રહેશે નહીં.

પાંચ ખેલાડીઓનું ડેબ્યૂ છતાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું

કાર્ડિફ

પાંચ ખેલાડીઓએ વન-ડેમાં ડેબ્યૂ કર્યો હોવા છતાં ઇંગ્લેન્ડે સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં પાકિસ્તાનને નવ વિકેટે પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. પાકિસ્તાનની ઈનિંગ ૩૫.૨ ઓવરમાં ૧૪૧ રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે એક વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મલાને ૬૯ બોલમાં આઠ બાઉન્ડ્રી વડે ૬૮ તથા ઝેક કોવલીએ ૫૦ બોલમાં સાત બાઉન્ડ્રી વડે ૫૮ રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ઈનિંગ્સમાં ઓપનર ફખર ઝમાને ૪૭ તથા શાદાબ ખાને ૩૦ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે સાદિક મેહમૂદે ૪૨ રનમાં ચાર વિકેટ ઝડપી હતી.

ઓલિમ્પિક પહેલાં ટોક્યોમાં ઇમરજન્સી, પ્રેક્ષકો નહીં દેખાય

ટોક્યો

કોરોના વાઈરસની મહામારીના સતત વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખીને જાપાનીઝ સરકારે ટોક્યોમાં ઇમરજન્સી લાગુ કરી છે. ટોક્યો ઓલિમ્પિકને હવે માત્ર બે સપ્તાહ જેટલો સમય બાકી રહી ગયો છે ત્યારે સરકારના નિર્ણયને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ અને સ્થાનિક જાપાનીઝ આયોજકોએ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ નહીં આપવામાં આવે તે નિર્ણયને ધ્યાનમાં રાખીને માત્ર ટીવી ઉપર રમતોનું પ્રસારણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. કેટલાક સમય પહેલાં આયોજકોએ વિદેશી સમર્થકો ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો અને હવે સ્થાનિક પ્રેક્ષકો ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો છે.

સુરતના દીપક કાબરાની ટોક્યો ઓલિમ્પિકમાં જજ તરીકે પસંદગી

ખેલાડી તરીકે સિલેક્ટ ન થવાનો અફસોસ

સુરત: સુરતના દીપક કાબરા ટોક્યો ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થયા છે. જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં સિલેક્ટ થનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે ખેલાડી તરીકે ઓલિમ્પિકમાં સિલેક્ટ ન થવાનો રંજ જજ તરીકે સિલેક્ટ થઈને પૂર્ણ કર્યો છે. આગામી દિવસોમાં



કાબરા ટોક્યો ઓલિમ્પિકમાં મેન્સ જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થયા છે. ઓલિમ્પિકમાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં સિલેક્ટ થનાર ભારતના પ્રથમ જજ બનવાનું બહુમાન મળ્યું છે.

ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિકમાં તેઓ જજ તરીકે સેવા આપશે. જાપાનના પાટનગર ટોક્યોમાં આગામી ૨૩ જુલાઈથી ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થઈ રહ્યો છે. ઘોડદોડ રોડ પર ઈન્ડોર સ્ટેડિયમ સામે સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા દીપક સુરેન્દ્ર

જ્યારે ખેલાડી તરીકે જિમ્નાસ્ટિક્સમાં રમતો હતો ત્યારે ઓલિમ્પિક સુધી પહોંચી શક્યો ન હતો. તેથી, મને ઓલિમ્પિકમાં ન પહોંચવાનો અફસોસ હતો. બાદમાં સ્પોર્ટ્સ સાથે જોડાણ શરૂ રાખવા મેં જજ તરીકે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું.

આર્જેન્ટિનાનો ફાઇનલમાં પ્રવેશ, પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને ૩-૨થી હરાવ્યું

રિયો ડી જાનેરો: કોપા અમેરિકાની ફાઇનલ માટેના દાવેદારો નક્કી થઈ ગયા છે. કોપા અમેરિકાની ફાઇનલ નેયમારના બ્રાઝિલ અને લિયોનલ મેસ્સીના આર્જેન્ટિના વચ્ચે રમાશે. મંગળવારે બ્રાઝિલ ક્વોલિફાય થયા બાદ બુધવારે આર્જેન્ટિનાએ પણ પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું હતું. સેમિફાઇનલમાં આર્જેન્ટિનાએ ૩-૨થી વિજય મેળવ્યો હતો. કોપા અમેરિકાની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાનો ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝ મેચનો હીરો સાબિત થયો હતો. તેણે ત્રણ પેનલ્ટી ગોલ રોકીને આર્જેન્ટિનાને મહત્વપૂર્ણ વિજય અપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સેમિફાઇનલ ૧-૧થી ટાઈ થઈ હતી. પેનલ્ટી શૂટઆઉટ દ્વારા મેચનો નિર્ણય કરવાનું નક્કી કરાયું હતું.

HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.



CENTURY 21

Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

- Free Staging
- Free Professional Photography & virtual tour
- Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- Free Comparative Market Analysis
- Team of Professional for same price as hiring a single realtor
- Over 15 years of combined experience



1210 Radom
St Unit 502, Pickering

JUST SOLD
106%
of the asking price!



5580 Sheppard Ave E.
Unit 1004, Toronto

Just Purchased
for Buyer Client
below asking price!



- No Pressure
- No Obligation
- Just Answers to Your Questions...Its that Simple!

You have Nothing to Loose...Call us for a Free Consultation on How to Get Started.

Use The Advantage of a Team,
Because...Teamwork Makes Your Dreams Work !

Shamim & Amin Kharodia

Broker of Record / Sales Representative
teamkharodia@gmail.com

300-2855 Markham Rd Toronto ON M1X 0C3

D: (647) 501-6786 | D: (647) 308-2941
F: (416) 298-8303 | P: (647) 666-8676



Grand Centurion Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.









Lapoto Finish

પોર્સેલિન
ટાઈલ્સ શરૂ થાય
છે ફક્ત
\$ 0.89 થી

**Porcelain tiles starting from
\$0.89 per square
feet only**

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking



Matt Fiish

સિરામિક
ટાઈલ્સ શરૂ
થાય છે
\$ 0.50 થી

**Ceramic tiles starting from
\$0.50 per square
feet only**

- ◆ પોર્સેલિન ટાઈલ્સ અને સિરામિક ટાઈલ્સ ફેક્ટરી ભાવે મળશે
- ◆ અમારા ભાવની ખાત્રી કરી શકો છો. વધારાના ૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે
- ◆ ફ્લોર, દિવાલ અને આઉટડોર પાર્કિંગની ટાઈલ્સ મળશે

:- Available Size :-

24" * 24" | 12" * 24" | 24" * 48" | 4" * 8" | 4" * 12"

MONTREAL

3590, Rue Griffith, Saint Laurent, QC, H4T 1A7
Phone: +1-514-260-2242 /
+1-514-813-3850

OTTAWA

Unit #4+5, 200 Colonnade Road,
Nepean, ON, K2E 7M1
+1-613-601-1474

MISSISSUAGA

5030 Maingate Drive, Unit#1, Mississauga, L4W 1X5
Phone: +1 (647) 527-6030 /
+1-514-813-3850

<https://clubceramic.com> Email : sales@clubceramic.com

MOTEL for SALE

NIRAJ PANCHOLI, REALTOR®

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: ncpancholi@gmail.com
Website: <https://niraj-pancholi.c21.ca/>

Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...

Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings



MOTEL KING : Specializing in Selling Motels: LIST & SELL with confidence

<p>18 Room Motel Near Pembroke - \$925,000 1.5 hrs from Ottawa / 4 hrs from GTA</p>	<p>14 Room Motel Near Ottawa - \$999,000 Within the city, 4 rooms with full kitchenette Low operating costs. All amenities near by</p>
<p>42 Room Motel Near Timmins - \$1,300,000 On Hwy 11, Within the city, indoor corridor</p>	<p>27 Room Motel in Thunder Bay - \$1,999,000 60 Room Motel in Thunder Bay - \$2,000,000</p>
<p>Small to Mid-Size Motels in Northern Ontario Price: \$1,300,000 to \$2,000,000</p>	<p>30+ Room Motel Near Sudbury - \$2,000,000 VTB available, 40% down payment require from buyer</p>
<p>Other 15 to 40 Room motels coming up for sale Price: \$1M to \$3.5M - Buyers with 40% down, get ready</p>	<p>Recently SOLD Motels Near Welland, London, Sarnia, North Bay, Cochrane, Sudbury</p>

Motel Job or Working Partner opportunity

@ Experienced Motel Operator: to run motel in northern Ontario, English & computer knowledge require. Good salary.
@ Working Partner: willing to invest minimum \$200K, offering 25% to 50% partnership + management salary to run the motel in north

SERIOUS BUYERS: you must need about 35% down payment & to sign buyer representation agreement.
Call for personal meeting to see motel's financial & to discuss mortgage options. Private finance available.

Century 21 People's Choice Realty Inc., 120 Matheson Blvd E, Unit 103, Mississauga, L4Z 1X1 Office Ph.: 905-366-8100